

# ગુજરાતી ભાષાનું વ્યાકરણ.

કિમત પોણા બે અના.

# ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ ગુજરાતી કોણ્ઠારાચિત્ર વિભાગ ]

અનુક્રમાંક ૪૧-૧૪ દાખાંક

પુસ્તકનંબર ૨૫૮૨૧ લાખાડું એડિશન

વિષય ૩૪:૬૪૩:૮-

મુંબઈ દલાકાનું સરકારી કેળવણીખાતું.

## ગુજરાતી ભાષાનું વ્યાકરણ.

રચનાર,

ગંગાશંકર મહિશંકર વૈષણવ,

ખા. એ., ખા. એસરી.

શિક્ષક-પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કેનેજ,

અમદાવાદ.

ઇપાવી પ્રસિદ્ધ કરનાર,

ચીમનલાલ ચુન્નીલાલની કુંપની,

માદીકઃ-ચીમનલાલ માણેઠલાલ.

અમદાવાદ.

સન ૧૮૬૭ના ૨૫મા એકદ્દ મુજબ આ પુરતથ

ડોપીરાઈને માટે રજીસ્ટર કરાયું છે.

આવતી ત્રીજ.      પ્રત ૬૦,૦૦૦.

-૩૧૦-

ધ. સ. ૧૬૧૩.

સર્વે ક્રમ સ્વાધીન.

કિ. પોણા એ આના.

ગુરૂત્વ વિદ્યાપીઠ ગુંજાલું  
નાના દાવાદ  
ગુજરાતી ડૉ. પીરાઈટ-સંગ્રહ

૧૯૮૫. ૭ -

૮૮૧૪

“શ્રી સત્યનારાયણ” પ્રિન્ટિંગ પ્રેસમાં  
પટેલ મોતીલાલ કાળીદાસે છાપ્યું.  
ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે-અમદાવાદ.

## પ્રસ્તાવના.

મે. હોપ સાહેબે બનાવેલા ‘ગુજરાતી ભાષાના વ્યાકરણ’ ને ખફલે વ્યાકરણ શાખવાની નવીન પદ્ધતિ અનુસાર ગુજરાતી પ્રાથમિક શાખાઓમાં ઉપયોગી થઈ પડે એવું એક નવું વ્યાકરણ રચવવાની મુખ્યિધ્યાકાના સરકારી કેળવણીઘાતાને જરૂર જણાયાથી, નવીન પદ્ધતિસર એક નાનું વ્યાકરણ લખવાની એક સંપૂર્ણ યોજના તૈયાર કરી રણ્ણ કરવાનું મે. પણ્ણિક છન્સટકશનના ડિરેક્ટર સાહેબે પ્રે. રા. ટ્રે. કોલેજના પ્રિન્સિપલ મે. કમળાંશકરભાઈનો ઇરમાંયું. આ ઉપરથી તેમણે નિપયવાર એક સંપૂર્ણ યોજના ઘડી કાઢી, મે. પણ્ણિક છન્સટકશનના ડિરેક્ટર સાહેબને રણ્ણ કરી આ યોજના તએ સાહેબને સંપદ પડી, અને તેને અનુસરી એક નાનું ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખવાનું કાંઈ મે. કમળાંશકરભાઈની ભવામણું ઉપરથી મને સોંપવામાં આવ્યું.

મે. કમળાંશકરભાઈની સંપૂર્ણ મદ્દ અને સૂચનથીજ આ વ્યાકરણ રચવા હું શક્તિમાન થયો છું.

આ નવીન વ્યાકરણ લખવામાં ‘ગુજરાત શાળાપત્ર’ માં આવેલા વિદ્યાભરેલા અને મનતન કરવા યોગ્ય વ્યાકરણુને લગતા લેખોનો મેં સંપૂર્ણ દૃષ્ટથી ઉપયોગ કર્યો છે. આ બધા લેખોનો ઉપયોગ કરવા હેવા સાર પણ પ્રે. રા. ટ્રે. કોલેજના પ્રિન્સિપલ, અને ‘ગુજરાત શાળાપત્ર’ ના તન્ની મે. કમળાંશકરભાઈનો જહેર રીતે ઉપકાર માનવાની આ અમૂલ્ય તક મારે ગુમાવવી જોઈએ નહિ.

અમદાવાદ.  
પ્રે. રા. ટ્રે. કોલેજ કાર્યાલાય.  
૧૯૧૦.

ગંગાંશકર મણિશાંકર વૈષ્ણવ,

# અનુક્રમણિકા.

---

વિપુલ.	પૂર્ણ.
વાક્ય.....	૧- ૨.
નામ અને કિયાપદ. ....	૨- ૩.
અક્ષરવિચાર .....	૩- ૪.
સ્વર.....	૪.
વંજન.....	૪- ૬.
બારાખડી.....	૬- ૮.
નામ.....	૮-૧૦.
સર્વનામ.....	૧૦-૧૩.
ભાતિ.....	૧૩-૧૫.
વચન .....	૧૫-૧૭.
વિલક્ષિત.....	૧૭-૨૦.
નામનાં રૂપાખ્યાન..	૨૦.
સર્વનામનાં રૂપા-	
ખ્યાન.....	૨૦-૨૩.
કિયાપદ.....	૨૩-૨૪.
કર્તા અને ઉદ્દેશ્ય. ....	૨૪-૨૫.
કાળ.....	૨૫-૨૭.
અર્થ .....	૨૭-૨૮.
પ્રયોગ.....	૨૮-૩૦.
ધાતુ .....	૩૦-૩૨.
કિયાપદના પદચેદના	
નમુના.....	૩૨-૩૩.
ઉદ્દેશ્ય .....	૩૩-૩૪.
વિશેષ.....	૩૪-૩૫.
વાક્યના ભાગ.....	૩૫.
પૃથક્ષણ.....	૩૬-૩૮.
વિપુલ.	પૂર્ણ.
વિશેપણ.....	૩૬-૪૧.
અવ્યય.....	૪૧-૪૫.
વાક્યના પ્રકાર....	૪૫-૪૮.
વાક્યપૃથક્કરણના	
નમુના .....	૪૮-૫૧.
ઉભાનાવયી અવ્યય..	૫૨.
વિલક્ષિતા.....	૫૨-૫૬.
વીજુ અને સાતમી	
વિલક્ષિત.....	૫૬-૫૭.
કૃદંત. ....	૫૭-૫૮.
કાળ પ્રમાણે કૃદંતના	
પ્રકાર. ....	૫૮-૬૦.
મિશ્રકાળ.....	૬૦.
સંયુક્ત કિયાપદ....	૬૧.
અધ્યાતુ વર્તમાનકાળ. ૬૧-૬૨.	
વિશેપણ વિષે વિશેપ	
વિચાર.....	૬૨-૬૩.
લોઈએ .....	૬૩-૬૪.
પદચેદના નમુના...૬૫.	
કેવળપ્રયોગી અવ્યય.૬૫.	
સમાસ.....	૬૫-૬૬.
સમાસના પ્રકાર... ૬૬-૬૮.	
સ્થિતિ.....	૬૮.
સ્વરગંધિ .....	૬૮-૭૦.
વંજનસ્થિ.....	૭૦-૭૧.
વિરામચિહ્ન.....	૭૧-૭૫

---

# ગુજરાતી ભાષાનું વ્યાકરણ.

વાક્ય.

‘ગાય અરે છે,’ ‘એન રડે છે,’ આમ ઓલવાથી ઓલવાનો અર્થ પુરેપુરે સમજાય છે; પરન્તુ ‘એન ચોપડી,’ ‘ભાપા ધરમાં,’ ‘માને જોઈને,’ એ પ્રમાણે ઓલવાથી ઓલવાની મતલબ પૂરી સમજાતી નથી. અધુરો અર્થ પુરો કરવા કંઈક નીચે સુજાય ઓલાયઃ—

‘એન ચોપડી વાંચે છે.’

‘ભાપા ધરમાં નથી.’

‘માને જોઈને ભાગક હરખાય છે.’

વળો ‘એસો,’ ‘આવજો,’ એમ ગોક શાંદ ઓલવાથી પણ કહેવાની મતલબ પૂરી સમજાય છે.

એક કે એકથી વધારે શાખથી ઓલનારનો પુરેપુરે અર્થ સમજી શકાય, ત્યારે વાક્ય બને છે. વાક્યના એ ભાગ.

‘શિક્ષક આબ્યા,’ ‘બિલાડીએ ઉંદર પકડ્યો,’ આ વાક્યોમાં કોને માટે કહેવામાં આવ્યું છે? ‘શિક્ષક’ અને

\* ‘વ્યાકરણ’ શાખનો અર્થ એવો છે, કે વ્યાક્રિયન્તે શાન્દા અનેનેતિ વ્યાકરણમૂ, એટલે જે વડે શાખનું સ્પષ્ટીકરણ થાય તે વ્યાકરણ. અર્થાત्, પ્રકૃતિપ્રત્યયના વિલાગ દર્શાવી શાખની સ્ફુરતિ આપી હોય, તથા શુદ્ધ શાખનામાં જોવામાં આવતા નિયમો તેમજ તે શાખનું વર્ગીકરણ, પ્રકાર, ઈત્યાદિ વિષયો પર જેમાં અર્થા કરી હોય તે ‘વ્યાકરણ.’

‘બિલાડી’ ને માટે શું કહેવામાં આવ્યું છે? ‘આવ્યા,’ અને ‘ઉદ્રે પકડ્યો,’ એમ. કેંઈ પણ વાક્યના ત્યારે એ ભાગ થાય છે:—જેને માટે કહેવામાં આવ્યું હોય તે એક ભાગ, અને જે કંઈ કહેવામાં આવ્યું હોય તે બીજે ભાગ.

વાક્ય. એને માટે (ઉદ્દેશ્ય\*) શું કહ્યું (વિધેય\*)

૧. આડ પડ્યું. આડ. પડ્યું.

૨. છોકરો જાંધે છે. છોકરો. જાંધે છે.

૩. કુતરો રોઠલો ખાય છે. કુતરો. રોઠલો ખાય છે.

### નામ.

જેને માટે કંઈક કહેવામાં આવે છે, તેનું કંઈક નામ પાડેલું હોય છે. નામ પાડવાથી પ્રાણી, પદ્ધાર્થ, ગુણું, વગેરે ઓળખાય છે. ‘માણસ,’ ‘મગનલાલ,’ ‘આડ,’ ‘લાકડું,’ ‘બ્રાન્ચ,’ ‘ગળપણું,’ વગેરે નામો છે. આમાં ‘માણસ’ ને ‘મગનલાલ’ એ પ્રાણીનાં નામ છે, ‘આડ’ અને ‘લાકડું’ એ પદ્ધાર્થનાં નામ છે, ને ‘બ્રાન્ચ’ ને ‘ગળપણું’ એ ગુણુનાં નામ છે.

નામ એટલે જે શબ્દ વડે પ્રાણી, પદ્ધાર્થ, ગુણું, વગેરે ઓળખાય છે તે.

### કિયાપદ.

‘ધોડા દોડે છે,’ આ વાક્યમાં ધોડાને માટે ‘દોડે છે’ એમ કહ્યું છે. ધોડા કંઈ કામ કે કિયા કરે છે. ‘દોડે છે’ શબ્દથી આ કિયા સમજાય છે.

\*આ શબ્દો ત્રીજે ધોરણમાં શીખવવા નહિ. તેનો ખુલાસો આગળ ઉપર આવશે.

**કિયાપદ**—જે પદ કે શાખથી કોઈ પણ જાતની કિયા બતાવાય તે. કિયાપદ એટલે કિયા બતાવનારો શાખથી.

### કિયાપૂરક.

‘રામે ભાર્યો,’ ‘વાધે કાડી ખાદું,’ ‘સુધાર બનાવે છે,’ આ પ્રમાણે બોલવાથી આ વાક્યોમાં થતી કિયાના પુરેપુરા અર્થ સમજ શકતા નથી. અધુરા અર્થ પુરા કરવા વાક્યોની અંદર બીજ શાખો ઉમેરવાની જરૂર છે.

‘રામે રાવણુને ભાર્યો.’

‘વાધે હરણુને કાડી ખાદું.’

‘સુધાર મેળ બનાવે છે.’

આ પ્રમાણે બોલવાથી કિયાના અર્થ બરાબર સમજય છે. ‘રાવણું,’ ‘હરણું,’ અને ‘મેળ,’ એ શાખો કિયાના અધુરા અર્થ પુરા કરે છે. આ શાખો ‘નામ’ છે. તેઓ ‘કિયાપૂરક’\* કહેવાય છે.

### અક્ષરવિચાર.

#### શાખ અને અક્ષર.

‘એસો,’ ‘કશુનાર બિડયું,’ ‘પોપટે ભરયું’ ખાદું,’ ‘આ અમારી નિયાળ છે.’ આ વાક્યો તપાસનાં જણાશે કે તેમાં એક કે એકથી વધારે શાખો આવેલા છે. પહેલા વાક્યમાં એક, બીજમાં એ, ત્રીજમાં ત્રણ, અને ચોથામાં ચાર છે. હવે ‘એસો’ એ શાખમાં ‘એ,’ અને ‘સો’

\* નામ સિવાયના બીજ શાખો પણ ‘કિયાપૂરક’ તરીકે આવે છે, પણ તેનું વિવેચન આગળ હપર આવશે.

એવા એ ‘અક્ષર’ છે, અને તેજ પ્રમાણે ‘પોપર’ માં ‘પો,’ ‘પ,’ અને ‘ટ,’ મળી નાણું અને ‘અમદાવાદ’-માં પાંચ અક્ષરો આવે છે ‘છા,’ ‘જૂ,’ વગેરે શાખદ માત્ર એકજ અક્ષરના બનેલા છે. કોઈ પણ શાખદ એક કું એકથી વધારે અક્ષરનો બનેલો હોય છે.

---

### સ્વર.

‘અમદાવાદ’ શાખદ લો. આ શાખદમાં પહેલા અક્ષર-નો એટલે ‘અ’ નો ઉચ્ચાર એતી મેળે કે આપોઆપ થઈ રહે છે. આજ પ્રમાણે ‘આ,’ ‘ઈ,’ ‘ઈ,’ ‘ઉ,’ ‘ઊ,’ ‘એ,’ ‘ઓ,’ ‘ઓા,’ ‘ઔંા,’ ના ઉચ્ચાર પણ આપોઆપ થાય છે. જો અક્ષરોના ઉચ્ચાર કરવામાં ભીન કોઈ પણ અક્ષરની મદદ લેવી પડતી નથી. આવા બધા અક્ષરને ‘સ્વર’ કહે છે.

### દ્વારા સ્વર.

દ્વારા (જેનો ઉચ્ચાર દુંકો છે એવા ) સ્વર.

આ, ઈ, ઉ, ઊ, અને લુ.

દીંધ્ર ( જેનો ઉચ્ચાર લાંબો છે એવા ) સ્વર.

આ, ઈ, ઉ, ઊ, એ, ઓ, ઓા, ઔ.

અ, અં અને લુને ગંસકૃત લાપામાં સ્વર ગણેલા છે. ગુજરાતી ભાપામાં અનો ઉપરોગ થાડો છે; અં ને લુ ને નહિ કંવો છે.

---

### વંજન.

‘અમદાવાદ’ નો ઉચ્ચાર કરતાં ‘અ’ નો ઉચ્ચાર

કોઈ પણ અક્ષરની મદદ લીધા વિના થઈ શકે છે; પરન્તુ તેજ શામના ખીજ અક્ષર ‘મ’ નો ઉચ્ચાર કરતાં ‘મ’ની સાથે ‘એ’ બેગાવીયું તોજ ‘મ’ એનો ઉચ્ચાર થશે, તેવીજ રીતે ખીજ અક્ષરો ‘દા’ ‘વા’ એને ‘દ’ નું સમજવું.

જે અક્ષરોના ઉચ્ચાર કરતાં કોઈ પણ સરરની મદદ લેવી પડે છે-એટલે જે અક્ષરોના ઉચ્ચાર કરતાં માટે તેની સાથે કંઈક વિશેષ આંજનું કે મેળવવું પડે છે તેને ‘વંજન’ કહે છે.

કુન્ડ વંજન નીચે મુજબ છે:—

ક, ખ, ગ, ઘ, ઙ, ચ, છ, જ, ઝ, ઝુ, દ, દુ,  
ં, ંદ, ંઘ, ંઝ, ંચ, ંઘ, ંઝ, ંચુ, ંઘુ, ંઝુ, ંચું, ંઘું, ંઝું, અને ં.

કુંડ થી માંડી ક, સુધીના વંજનો કંઈક કે ગળામાંથી બોલાય છે. તેવીજ રીતે ચુંદી થી ખ સુધીના તાળવામાંથી, દુંધા ણ સુધીના મૂર્ખાંથી, ત થી નું સુધીના દાંતથી, પુંધી ભ સુધીના હોઠથી બોલાય છે. અમ હોલાથા આ સ્થાનો પ્રમાણે વંજનોના નીચે મુજબ વર્ગ પાડવામાં આવ્યા છે.

વર્ગો.

સ્થાન.

૧. ક વર્ગ-કુ, ખુ, ગુ, ઘુ, ઙુ (ં).....કંઈકસ્થાન.
૨. ચ વર્ગ-ચુ, ઝુ, ઝ, ઝુ, ઝુ (ં, અને શ). નાલુંશથાન.
૩. ટ વર્ગ-દુ, ઠુ, ં, ંદ, ંઘ, (ં, પુ, અને ણ). મૂર્ખાંસ્થાન.
૪. ત વર્ગ-તુ, થુ, દુ, ધુ, નુ, (સ અને લ). દાંતસ્થાન. {
૫. પ વર્ગ-પુ, પુ, બુ, ભુ, .... ઓછસ્થાન. } ૧

## અર્ધસ્વર.

ય, ર, લ, અને વ, ના ઉચ્ચચાર કંઈક સ્વર જેવાથાય છે, માટે તે 'અર્ધસ્વર' કહેવાય છે.

## ખારાખડી.

૧. ક + અ = કા.
૨. ક + આ = કા.
૩. ક + ઈ = કિ.
૪. ક + ઈ = કી.
૫. ક + ઊ = કુ.
૬. ક + ઊ = કૂ.
૭. ક + એ = કે.
૮. ક + એ = કે.
૯. ક + ઓ = કો.
૧૦. ક + ઓ = કૂ.

ઉપર ખતાવ્યા સુજગ દસ અક્ષર થયા. તેમાં 'ક' અને 'કો' ઉમેરવાથી કુલ બાર થાય. એ ખતા મળી બાર અક્ષર થયા, માટે તેને 'ખારાક્ષરી' કે 'ખારાખડી' કહે છે.

ખારાખડી લખવામાં વંબજનતી સાથે આખા સ્વર નહિ, પણ તેની અમુક અમુક નિશાનીઓન જોડી હેવામાં આવે છે. નીચે નિશાનીઓ અને તેનાં નામો આપેલાં છે.

સ્વર.                    નિશાની.                    નિશાનીનું નામ.

અ.                        નથી.                        નથી.

(માટે ખારાખડીમાં 'ક' ને કંઈકનહિ 'ક' કહેવાય છે)

આ.                        |                            કાનો.

ઈ                            |                            ઈસ્વ ઈ (ઇસ્વ અજગ્યુ).

ઈ.	૧	દીર્ઘ ઈ ( દીર્ઘ અજણુ ).
ઉ.	૨	હૃસવ ઉ ( હૃસવ વર્કુ ).
ળ.	૩	દીર્ઘ ઉ ( દીર્ઘ વર્કુ ).
એ.	૪	એક માત્રા.
એ.	૫	એ માત્રા.
ઓ.	૬	કાનો માત્રા.
ઓ.	૭	કાનો એ માત્રા.
અં.	૮	અતુસવાર.
અઃ.	૯	વિસર્ગ.

### અતુસવાર.

સ્વર ઉપર ( જેમકે, અં, ઈ, ઉ, વગેરે ) ને આવું ( . ) ટ્યું મૂકવામાં આવે છે તેને 'અતુસવાર' ( સ્વરની પાછળ બોલાય છે માટે ) કહે છે.

### વિસર્ગ.

સ્વર ( અઃ વગેરે ) પણ આવાં ( : ) એ ટ્યુકાં મૂકવામાં આવે છે તેને 'વિસર્ગ' કહે છે. આ ટ્યુક ઉમેરવાથી અક્ષરનો ઉચ્ચાર છાતીમાંથી બહાર ઝેંકાઈ જતો હોય એટલે ' હુ ' જેવો થાય છે.

### લોડાક્ષર.

'પ્ર,' એ 'પુ,' 'રૂ,' અને 'અ' નો બનેલો છે. 'ત્ર' માં 'તુ,' 'રૂ,' અને 'અ' છે. તેવીજ રીતે 'ક્ષ' માં કુ + ષ્ઠ + અ, અને 'શ' માં જ્ઞ + ષ્ઠ + અ, છે. 'ધા' માં દ્વ + ષ્ઠ + આ છે.

એ કે બ્યુથી બધારે બ્યંજનો સાથે આવી તેનો એકજ અક્ષર બને, ર્યારે તે અક્ષરને લોડાક્ષર કહે છે.

### અહૃપપ્રાણુ.

ક, ચ, ટ, ત, પ, વગેરે કેટલાક વ્યંજનોના ઉચ્ચચાર કરતાં ભાલૂમ પડશે, કે તેના ઉચ્ચચાર કરતાં થોડો શાસ જોઈએ છે. આ કારણુથી નીચેના વ્યંજનો ‘અહૃપપ્રાણુ’ કહેવાય છે.

ક, ચ, ટ, ત, પ; ગ, ઙ, દ, ઢ, ઘ; ય, ર, લ,  
વ, ણ; હ, અ, ણુ, ન, મ.

### મહાપ્રાણુ.

ખ, છ, ઠ, વગેરે કેટલાક વ્યંજનોના ઉચ્ચચાર કરતાં વધારે શાસ જોઈએ છે, માટે તેવા વ્યંજનોને ‘મહાપ્રાણુ’ હલે છે. નીચેના વ્યંજનો મહાપ્રાણુ છે.

ખ, છ, ઠ, ધ, ળ; ધ, ઝ, દ, ધ, લઃ શ, પ, સ, હ.  
ગ, ઙ, દ, દ, ઘ; ધ, ઝ, દ, ધ, લઃ હ, ણુ, ન, મ;  
ય, ર, લ, વ, હ અને ણ; આ બધા વ્યંજનો ‘શોષ’ કહેવાય છે.

ક, ચ, ટ, ત, પ; ખ, છ, ઠ, ધ, ળ; શ, પ અને  
સ, આ બધાને ‘અધોષ’ વ્યંજન કહેવામાં આવે છે.

### નામ.

શરાતમાં વાક્ય અને તેના એ મુખ્ય ભાગ ‘ઉદ્દેશ્ય’ અને ‘વિધેય’ માટે હશ્યું છે. ‘લાક્કું સળગે છે,’ ‘મોતીલાલ હસે છે,’ ‘ગળપણુ વધારે છે,’ આ વાચ્ચોમાં ‘લાકડા,’ ‘મોતીલાલ,’ અને ‘ગળપણુ’ વિષે કુંઈ કહેવામાં આવ્યું છે. આ વણે શબ્દો નામ છે, પરન્તુ તે નામ એકજ જાતનાં નથી. દરેક નામનો પ્રકાર હવે નાફી હરીએ.

ને દરેક વસ્તુને માટે જુદું જુદું નામ હોય, તો  
નામની સંપ્રાણો પાર રહે નહિ, માટે એકો જાતની  
અને સરખા ગુણવાળી વસ્તુઓનું-પ્રાણી કે પદ્ધતિનું-  
સાધારણું કે સામાન્ય નામ (બધી વસ્તુને લાગુ  
પડે એવું) ઠરાવેલું છે.

‘લાકું સળગે છે’ એ વાક્યમાં ‘લાકું’ સામાન્ય નામ છે. છાકરો, શહેર, પર્વત, મેજ, કાગળ, ધઉં, સોનું, લશકર, વગેરે સામાન્ય નામો છે.

- |                    |                     |
|--------------------|---------------------|
| ૧. છોકરો હસે છે.   | ૧. મોતીલાલ હસે છે.  |
| ૨. છોકરી ડાહી છે.  | ૨. ગંગા ડાહી છે.    |
| ૩. શહેર સુંદર છે.  | ૩. મુખ્ય સુંદર છે.  |
| ૪. પર્વત ઉચ્ચો છે. | ૪. હિમાલય ઉચ્ચો છે. |

આ બંને ખાનાં તપાસો. અ ખાનામાં ‘છોકરો,’ ‘છોકરી,’ ‘શહેર’ અને ‘પર્વત’ એ ‘ઉદ્દેશ્ય’ છે. આ ઉદ્દેશ્યથી ક્યા ખાસ છોકરો, છોકરી, શહેર, કે પર્વત વિષે કહ્યું છે તે સમજાતું નથી.

આ બધા શયદો એક વસ્તુ માટે તેમજ આખા વર્ગને  
માટે હરાવેલાં નામે છે.

વ ખાનામાં આપેલા શબ્દો ‘મેતીલાલ,’ ‘ગંગા,’  
 ‘મુંબઈ,’ અને ‘હિમાલય’ ઉદ્દેશ્ય છે. આ શબ્દોથી કંઈ  
 ચોક્સ વર્સ્તુ-પ્રાણી કે પદાર્થ-વિષે કહ્યું છે તે સ્પષ્ટ સમ-  
 નાય છે.

\* આને 'ભત્તિવાચક' પણ કહે છે. ને ૧૮૯૮ પ્રાણી કે પદાર્થની જત એળજાને તે તે 'ભત્તિવાચકનામ' કહેવાય.

આ બધાં નામો ‘વિશેષ નામ’ કહેવાય છે.

એકજ પ્રાણી કે પદાર્થનું ખાસ નામ પાતેલું  
હોય છે તે ‘વિશેષ નામ.’

‘ગળપણ વધારે છે,’ ‘લસ્કરે હિંમત બતાવી,’  
‘મને હુરખ થયો,’ ‘તને ઊંઘ આવે છે,’ ‘ધોડીની  
ચાલ ઉતાવળી છે,’ આ વાક્યો તપાસતાં જણાશે, કે  
‘ગળપણ’ અને ‘હિંમત’ એ ગુણનાં નામ છે. ‘હુરખ’  
એ લાગણીનું નામ છે; ‘ઊંઘ’ સ્થિતિનું અને ‘ચાલ’  
કિયાનું નામ છે. જે નામો ગુણું, લાગણી, સ્થિતિ, કે  
કિયાનાં નામો છે તેને ભાવવાચક કહે છે. ભાવ એટ-  
લેજ ગુણું, લાગણી, સ્થિતિ, કે કિયા.

## સર્વનામ.

‘છગનલાદે કંદું, કે છગનલાલ આજ જરો નહિ,’  
‘વનમાળીએ મગનલાલને કંદું, કે મગનલાલ વનમાળીને  
ઓલાવતો હતો, એ વનમાળી જાણુતો નહતો,’ ‘કેશવલાલ  
જતો હતો, તેવામાં કેશવલાલ પડી ગયો,’ આ બધાં  
વાક્યો કંદગાં દેખાય છે. એકનું એક નામ ફરીને  
વાપરવાને બદલે ઉપરનાં વાક્યો નીચે મુજબ ઓલાય છે,  
ત્યારે ઓલબું ઢીક લાગે છે. ‘છગનલાદે કંદું, કે હું  
આજ જઈશ નહિ,’ ‘વનમાળીએ મગનલાલને કંદું,  
કે તું મને ઓલાવતો હતો, એ હું જાણુતો નહતો,’  
‘કેશવલાલ જતો હતો, તેવામાં તે પડી ગયો.’

ઉપરનાં વાક્યોમાં ‘હું’ ‘તું’ અને ‘તે’ શબ્દો  
નામોને માટે વપરાયા છે, માટે તેને ‘સર્વનામ’ કહે છે.

નામને ઠેકાણું જે શબ્દ આવે છે તે સર્વનામ.

### સર્વનામના પ્રકાર.

#### પુરુષવાચક સર્વનામ.

‘હું દાખલા ગણું છું,’ ‘તું ક્યારે ગણુશે?’ ‘તે કોઈ દિવસ દાખલા ગણુટો નથી,’ ‘અમદાવાદમાં દીવાસળા બને છે?’ ‘હા, તે અહીં બને છે.’ પહેલા વાક્યમાં ઓલનાર માટે ‘હું’ ભીજમાં જેની સાથે વાત કરી છે તેને માટે ‘તું’ અને ત્રીજ તેમજ પાંચમાં વાક્યમાં ઓલનાર કે તેની સાથે વાત કરનાર સિવાય પ્રાણી કે પદાર્થ વિષે કહું છે તેને માટે ‘તે’ વપરાયા છે. હું, તું, તે, વગેરે ‘પુરુષવાચક’ સર્વનામ કહેવાય છે.

પહેલો પુરુષ સર્વનામ.	ભીજો પુ. સ.	ત્રી. પુ. સ.
હું, અમે, અમો,	તું, તમે, તમો.	તે, તેમો.
આપણું, આપણે.		

#### પ્રક્રિયવાચક સર્વનામ.

‘કોણ આવ્યું?’ ‘શું કરો છો?’ આ વાક્યોમાં ‘કોણ’ અને ‘શું’ એ સર્વનામો પ્રક્રિયવાચક વપરાયાં છે. કોણ. શો, શા, શું, વગેરે ‘પ્રક્રિયવાચક’ સર્વનામ કહેવાય છે.

પ્રક્રિય પૂછવામાં વપરાતાં સર્વનામો ‘પ્રક્રિયવાચક’ સર્વનામ કહેવાય છે.

#### સ્વવાચક સર્વનામ.

‘હું પોતે જઈશ,’ ‘તમે પોતે કહું,’ ‘રાજ પોતે ન્યાય આપે છે,’ પહેલા અને ભીજ વાક્યમાં ‘પોતે’ શાખ સર્વનામ અને ત્રીજમાં નામની સાથે વપરાયો છે. ‘પોતે’ એ શાખ ઓલનાર પોતાની જાતને માટે વાપરે

છે, માટે 'સુયવાચક' સર્વનામ કહેવાય છે. 'સ્વ' એટલે પોતાની જત.

### દર્શક સર્વનામ.

'આ ( છોકરાને બતાવાને ) ઓલ્યો.'

'પેલી ( છોકરીને બનાવીને ) હસે છે.'

'આ' નાણકની વસ્તુ-પ્રાણી કે પદાર્થ-માટે અને 'પેલી' જરા દૂરની વસ્તુને માટે વપરાય છે.

આ, એ, ઓલ્યો, પેલો, વગેરે 'દર્શક' ( બતાવનારાં ) સર્વનામ કહેવાય.

### અનિશ્ચિત સર્વનામ.

'હજુ કોઈ નિશાળે આવ્યું નથી,' 'આમાં કંઈક છે,' 'કેટલાક તો એઠલા ઉપર બેઠા હતા,' આમાં 'કોઈ,' 'કંઈક,' અને 'કેટલાક,' સર્વનામથી કોઈ નિશ્ચિત-નફ્ફા પ્રાણી કે પદાર્થ સમજાતો નથી. આવાં અનિશ્ચિત પ્રાણી કે પદાર્થ બતાવનારાં 'અનિશ્ચિત' સર્વનામ કહેવાય છે.

જે સર્વનામથી નિશ્ચિત પ્રાણી કે પદાર્થ નહિ, પણ મોઘમ એટલે ગમે તે કોઈએક પ્રાણી કે પદાર્થ સમજાય છે તે 'અનિશ્ચિત' સર્વનામ કહેવાય છે.

### સંખંધી સર્વનામ.

'જે ખાડો એડે તે પડે,' 'જેવું વાવશા તેવું લણુશા,' આ પ્રમાણે કહેવાને બદલે 'જે ખાડો એહે,' 'જેવું વાવશા,' એટદુંજ હજત કહેવામાં આવે તો બોબેલા .

શબ્દોની પાછળ હજુ કંઈક કહેવાનું બાકી છે એમ સમજાર્યુંછે. ..

‘જે’ અને ‘જે’ ઉપરથી થયેનાં ‘જેવું,’ ‘જેઠણું,’ અને ‘જેવું’ એ મંબંદી (મંબંધ રાખનારાં) સર્વનામો કહેવાય છે, કારણ કે તે વપરાય છે ત્યારે તેના મંબંધમાં કે તેની સાથે હેઠલાં ‘તે,’ ‘તેવું,’ ‘તેઠણું,’ અને ‘તેવું,’ ‘ફર્શીક સર્વનામું’ પણ અનુકૂમે વપરાયઃછે.

## જાતિ.

## નર જાતિ.

‘છાકરો હોડ્યો,’ ‘કાગડો જિડ્યો,’ ‘દોડો ઝીલ્યો,’ ‘છાકરો,’ ‘કાગડો’ ને ‘દોડો,’ નર કે પુરુષની જતનાં નામ છે. આ નામો નરની પેડે બોલાય છે, અને એને છેડે ‘ઓ’ આવેલો છે. નરની પેડે બોલતાં નામને છેડે ધણું કરી ‘ઓ’ આવે છે; પરન્તુ ‘છિગનલાલ ફૂદ્યો,’ ‘રાજ ગુસ્સે થયો,’ ‘હાથી ચાહ્યો,’ ‘લાડુ ખાધ્યો,’ આ વાક્યો તપાસતાં ભાવૂમ પડે છે, કે જે શબ્દોને છેડે ‘ઓ’ નથી હોતો. તે પણ નરની પેડે બોલાય છે.

જે શબ્દો નરની પેડે બોલાય છે, તે શબ્દો નર જાતિના છે, એટલે નરની જાતિના—વર્ગના-છે. નારી જાતિ.

‘છાકરી જડી,’ ‘સાહી ટળી,’ આમાં ‘છાકરી’ અને ‘સાહી’ નામો નારીની પેડે બોલાય છે. એવા શબ્દોને છેડે ધણું, કરીને ‘ઈ’ આવે છે; પરન્તુ ‘વાત ખની,’

‘બાંધા રાખી,’ ‘જૂ નીકળી’ ‘હરડે ખાંડી,’ ‘જળા મૂકી,’ આ વાક્યોમાં વપરાચેલાં નામને છેડે ‘ઈ’ આવતી નથી, છતાં તે નારીની પેડે બોલાય છે.

જે શાખદો નારીની પેડે બોલાય છે તે નારી જતિના કહેવાય છે.

### નાન્યતર જતિ.

‘છાકડે રડયું,’ ‘ગાડુ હંકયું,’ આ બંને વાક્યોમાં નામને છેડે ‘ઉ’ છે, અને તે નર કે નારીની પેડે બોલાતાં નથી. ધણ્ણું કરી આ જતનાં નામને છેડે ‘ઉ’ આવે છે; પરન્તુ ‘કલકત્તા મોદું છે,’ ‘મોતી પાણીદાર છે,’ ‘વસો નાનું છે,’ ‘લખનૌ પ્રખ્યાત શહેર છે;’ આ વાક્યોમાં નામને છેડે અનુકૂમે આ, ઈ, એ, અને ઓ છે.

નાન્યતર=ન+અન્યનર; જે શાખદોની જતિ અન્યતર-બેમાંથી એકે-નથી તે નાન્યતર જતિના છે.

જે શાખદો નર કે નારી જતિના નથી, તે નાન્યતર જાતના છે.

અમુક નામ નર, નારી, કે નાન્યતર જતિનું છે તે ‘કેવો,’ ‘કેણી,’ કે ‘કેવું,’ લગાડવાથી જણાય છે; જેમકે, ‘કેળા’ (કેવો) ન૦, ‘પાઠલાધો’ (કેણી) નારી૦, ‘ધર’ (કેવું) નાન્ય૦.

નર જતિનાં નામોમાંથી નારી જતિનાં નામો કેવી રીતે ઘનાવવાં ?

નર૦

શે૮૦

નારી૦

શેઠાણી.

કોળી.	કોળણ, કોળેણ.
કુતરો.	કુતરી.

આ દાખલા ઉપરથી સમજય છે, કે નર જાતિનાં નામેને 'પ્રત્યય'\* લગાડવાથી નારી જતિ બને છે. અણ, એણ, આણી, ણી, ઢી, ઢ્ઠ, વગેરે આવા પ્રત્યયો છે.

નરો.	નારી.
ભાપ.	મા.
પુરુષ.	સ્ત્રી.

કેટલાંક નામેની નારી જતિ જુદીજ રીતે થાય છે.  
નર જાતિમાંથી નારી જાતિનાં નામે પ્રત્યય  
લગાડવાથી કે તદ્દન જુદીજ રીતે થાય છે.

'સોપારી,' 'તમાકુ,' 'ચા,' આ અને ખીજ કેટલાક શબ્દો પ્રાન્તિક ભેદને લીધે જુદી જુદી જાતિમાં વપરાય છે.

### વચન.

'છોકરો,' 'લુગડુ' આ રૂપ ઉપરથી વસ્તુ એક છે એમ સમજય છે. 'છોકરા,' 'છોકરાઓ,' 'લુગડા,' કે 'લુગડાઓ,' બોલવાથી વસ્તુ એકથી વધારે છે એમ માલૂમ પડી આવે છે. 'છોકરો' અને 'લુગડુ' એ મૂળ ઇપોને પ્રત્યય લાગવાથી તેમાં બહુપણુનો અર્થ આવ્યો છે.

\* પ્રત્યય (પ્રતિ + અય; 'ઇ' જરૂર ઉપરથી) એક કે વધારે અસ્તર શબ્દને છેડે આવીને તેના અર્થમાં ફેર પાડે છે તે. 'મનમાં,' 'આઈને,' આમાં 'માં,' અને 'ઈને,' એ પ્રત્યય છે.

‘માણુસ આવ્યો,’ ‘માણુસ આવ્યાં,’ ‘મારા ધરમાં એક પેટી છે,’ ‘તમારા ધરમાં એ પેટી છે,’ ‘ઝડપડયું,’ ‘ઝડપડયાં’ આ વાક્યોમાં ‘માણુસ,’ ‘પેટી,’ અને ‘ઝડપ,’ આ શબ્દો એક અથવા બહુ-પણાનો ઘ્યાલ આપે છે. ‘માણુસ,’ એક કે એકથી વંચારે માણુસ.

‘માણુસો,’ ‘પેટીઓ,’ અને ‘ઝડો’ એ ઇપો ઉપરથી પણ વસ્તુઓ અનેક છે એમ સમજય છે.

જે શાખના ઇપમાં એકનો અર્થ હોય તે એક-વચન અને બહુનો અર્થ હોય તે બહુવચન.

જાતિ.	એકવચન.	બહુવચન.
નર.	હોકરો.	હોકરો—હોકરોઓ.
	લાડુ.	લાડુ—લાડુઓ.
નારી.	પાઠી.	પાઠી—પાઠીઓ.
નાન્યતર.	ઈડું.	ઈડાં—ઈડાંઓ.
	ગામ.	ગામ—ગામો.

તણે જાતિના શબ્દોમાં ભૂળ ઇપો બહુવચનમાં વપરાય છે, અથવા તે ઇપોને પ્રત્યય લગાડવાથી બહુવચન અને છે.

‘ધરુ’ આવ્યા,’ ‘ધરીઓ’ નીકલ્યા.’ અહીં નાગરાજેવાં નામો તેમજ બીજાં કેટલાંક નામો ગુજરાતીમાં બહુવચનમાંજ વપરાય છે.

‘દૂધ પીયું,’ ‘તેલ દુયું,’ ‘અહુંકાર થયો,’ આ વાક્યોમાં વપરાયેલાં નામો તેમજ તેવાં બીજાં કેટલાંક નામો ધર્યું કરી એકવચનમાંજ વપરાય છે.

## સર્વનામનાં જાતિવચન.

ભર્વનામ એ નામને ટેકાણેજ વપરાય છે, તેથી નામનાં ને જાતિવચન હોય છે, તેજ સર્વનામનાં પણ હોય છે.

---

## વિભક્તિ.

‘શિક્ષક પુસ્તક,’ ‘ચપુ ધડી,’ ‘ગોળી માર્યો,’ આ પ્રમાણે એલવાનો કંઈ અર્થ થતો નથી. ‘શિક્ષકનું પુસ્તક’ ‘ચપુથા ધડી,’ ‘ગોળીએ માર્યો,’ આમ કહેવાથી શબ્દ વચ્ચેનો સંબંધ અને તેથી કહેવાનો સુદૂર સમજય છે. ‘શિક્ષક’ અને ‘પુસ્તક,’ એ એ નામો વચ્ચેનો સંબંધ ‘શિક્ષક’ ને ‘નું’ પ્રત્યય લગાડવાથી રૂપદ થાય છે. ‘ચપુ,’ નામ અને ‘ધડી,’ કિયાપદનો સંબંધ ‘ચપુ’ને ‘થી’ પ્રત્યય લગાડવાથી સમજય છે, અને તેજ પ્રમાણે ‘ગોળી,’ અને ‘માર્યો’નો સંબંધ ‘ગોળી’ને ‘એ’ પ્રત્યય લગાડવાથી સમજ શકાય છે.

**વિભક્તિ-એટલે એક શબ્દનો ધીજ સાથે સંબંધ હેખાડનારા પ્રત્યય કે તે સાથેના શબ્દોનાં રૂપો—  
નેમકે, ધરમાં માણુસને, ગામથી, વગેરે.**

---

## સાત નિભક્તિઓ.

### પહેલી વિભક્તિ.

‘છાકરો દોડે છે,’ ‘પવન ઝૂકે છે,’ આ વાક્યોમાં ‘છાકરો,’ અને ‘પવન.’ પહેલી વિભક્તિમાં છે. પહેલી વિભક્તિમાં આવેલા શબ્દોને પ્રત્યય લાગતા નથી. ‘છાકરો,’

અને 'પવન,' કર્તા છે, પ્રથમા વિભક્તિ કર્તા હોય છે, પણ કર્તા એ વિભક્તિનો અર્થ ન હોવાથી એ કર્તાને પ્રથમા કહેવાતી નથી.\*

### બીજુ વિભક્તિ.

'હું ગણું છું,' 'રાજ ઓલાવે છે,' આ પ્રમાણે ઓલવાથી કોને માટે કહ્યું છે તેઠલું સમજાય છે. શું કહ્યું છે તે પુરેપુરે સમજાતું નથી. 'હું દાખલા ગણું છું' 'રાજ પ્રધાનને ઓલાવે છે,' એ પ્રમાણે 'દાખલા,' અને 'પ્રધાનને' શબ્દો ઉમેરવાથી એટલે કે કિયાના અર્થ પુરા કરનાર શબ્દ, કિયા જેના પર થાય છે એવી વસ્તુ બતાવનાર શબ્દ, ઉમેરવાથી વાક્યના અર્થ પુરેપુરા સમજાય છે. આ શબ્દને 'કર્મ' (કરેલું કે સાધેલું કામ) કહે છે. બીજુ વિભક્તિનો અર્થ 'કર્મ' છે. બીજુ વિભક્તિના શબ્દને પ્રત્યય લાગે કે ન પણ લાગે. 'ને' એ બીજુ વિભક્તિનો પ્રત્યય છે.

### ત્રીજુ વિભક્તિ.

'છાકરીએ રૂમાલ ગુંધ્યો.' 'રામથી રાવણ મરાયો.' અહીં પહેલા વાક્યમાં ગુંધ્યવાતું કામ કરનાર છાકરી છે. કિયા કરનાર એટલે કર્તા 'છાકરી' ત્રીજુ વિભક્તિમાં છે. તેમજ બીજા વાક્યમાં મારવાની કિયા રામથી થાય છે, એટલે કિયા કરનાર 'રામ' પણ ત્રીજુ વિભક્તિમાં છે. આ વિભક્તિના પ્રત્યય 'એ' તથા 'થી' છે.

'ગોળીએ કે ગોળીથી વાધને મારો,' આ વાક્યમાં 'ગોળી' એ 'કરણું' છે, એટલે તેનાથી કુંઈ કામ કરાયું છે. ત્રીજુ વિભક્તિનો અર્થ 'કરણું' પણ છે.

\* 'છાકરા' અને 'પવન'ની નિર્દેશવાચક પ્રથમા વિભક્તિ કહેવાય છે. નિર્દેશ એટલે શબ્દ કહેવો તે. પહેલી વિભક્તિનો અર્થ માત્ર 'નિર્દેશ' છે.

### ચોથી વિલક્ષિત.

‘શિષ્યે ગુરુને દક્ષિણા આપી,’ ‘ગુરુ’ શબ્દની ચોથી વિલક્ષિત છે; ‘ને’ એ ચોથી વિલક્ષિતનો પ્રત્યય છે. આ વિલક્ષિતનો મુખ્ય અર્થ ‘સંપ્રદાન’ (આપણું) છે.  
પાંચમી વિલક્ષિત.

‘ગરમીથી પાણી સુકાય છે.’ ‘અમદાવાહથી ગાડી ઉપડી.’ પહેલા અને બીજા વાક્યમાં ‘થી’ પ્રત્યય પાંચમીનો છે. પહેલા વાક્યમાં તેનો અર્થ ‘હેતુવાચક’ અને બીજામાં ‘અપાદાન’ (હૃદા પણું) છે.

### છદ્રી વિલક્ષિત.

‘રાજનો કુંવર,’ સંબંધ એ આ વિલક્ષિતનો અર્થ છે.

તો, ની, તુ, ના, નાં, એ છદ્રી વિલક્ષિતના પ્રત્યેઓ છે. તણો-ણી-ણું, કેરો-રી-રું, આ પ્રત્યેઓ છદ્રી વિલક્ષિતના છે, પરન્તુ તે કવિતામાં વપરાય છે.

### સાતમી વિલક્ષિત.

‘તે ગામડામાં રહે છે,’ ‘માયે પાઢડી છે,’ આમાં ‘માં,’ અને ‘એ’ પ્રત્યેઓ સાતમી વિલક્ષિતના છે. સાતમી વિલક્ષિતનો મુખ્ય અર્થ ‘અધિકરણુ’ (સ્થળ) છે.

‘મગનલાલ, અહીં આવ,’ આ વાક્યમાં ‘મગનલાલ’ ને બીજા શબ્દો જેડે ડાઈપણ જતનો સંબંધ નથી. ‘મગનલાલ’ એ પ્રત્યય વિનાનું વિશેષ નામ છે, અને તે સંઘોધનના એટલે બોલાવવાના અર્થમાં વપરાયું છે. આ અને આવી રીતે વપરાએલાં બીજાં નામો ‘સંઘોધનાથે’ પ્રથમાંનાં છે એમ કહેવાય.

## નામનાં ઇપાય્યાન.

‘વાડીમાંના સુ’ગા,’ ‘ધરમાંથી વીછી નીકળો,’  
 ‘તેઓમાંનાએ આ કામ કર્યું હશે,’ આમાં એવણું  
 વિલક્ષિતના પ્રત્યેં એક શખદાન લાગેલા છે. ડોઈ વેળા  
 એકજ શખદાન એવણું વિલક્ષિતના પ્રત્યેં લાગે છે.

---

## નામ.

## ઉંકારાંત નામ.

## દૃક્કુ.

## એકવચન.

## ૫ વચન.

૫ વિ. દૃક્કુ.	દૃડાં-દૃડાઓ.
બી. વિ. દૃક્કુ દૃડાને.	દૃડાં-દૃડાને-દૃડાંઓને.
ત્રી. વિ. દૃડાઓ-દૃડૈ.	દૃડાંઓ-દૃડૈ-દૃડાંઓએ.
ચો. વિ. દૃડાને (માર્દ, સાર)	દૃડાને-દૃડાંઓને.
પા. વિ. દૃડાથી-થકી.	દૃડાંથી-થકી. દૃડાંઓથા-થકી.
૭. વિ. દૃડાનો-ની-નું-ના-ના.	દૃડાનો-ની-નું-ના-ના. દૃડાંઓનો-ની-નું-ના-ના.
સા. વિ. દૃડામાં.	દૃડામાં-દૃડાંઓમાં.

## સર્વનામ (હું).\*

## એકવચન.

## બહુવચન.

૫. વિ. હું.	અમે-અમો.
બી. „ મને.	અમને-અમોને.
ત્રી. „ મે.	અમે-અમોએ.

\* મુને, સુજને, સુજથી, અમેથી, સુજ, મજમાં, અને સુજમાં  
 ઇંગ્રેઝ વપરાય છે.

ચો. „ અને.	અમને-અમેને.
પાં. „ મારાથી-થકી.	અમારાથી-થકી, અમથી-થકી.
છ. „ મારો-રી-રું-રા-રાં.	અમારો-રી-રું-રા-રાં.
સા. „ મારામાં.	અમારામાં-અમભાં.

આપણું.\*

બહુવચન.

પ. વિ.	આપણ-આપણે.
ભી. „	આપણું.
ત્રી. „	આપણે.
ચો. „	આપણું ( માટે, સારુ ).
પાં. „	આપણુથી-થકી.
છ. „	આપણો-એડી-એનું-એન્ના-એનું.
સા. „	આપણામાં.

આપ.

બહુવચન.

પ. વિ.	આપ.
ભી. „	આપને.
ત્રી. „	આપે.
ચો. „	આપને ( માટે, સારુ ).
પાં. „	આપથી-થકી.
છ. „	આપનો-ની-નું-ના-નાં.
સા. „	આપમાં.

\* ‘આપણે આ કામ કરીશું,’ ‘આપણું’ સર્વનામગાં જેની સાથે વાત કરવામાં આવે છે, તેનો પણ સમાવેશ થાય છે. ‘અમે ગામ ગયા’ અહો ‘અમે’ સર્વનામ જોલનારા પોતાને માટેજ વાપરે છે.

તે.

એકવચન.

અહુવચન.

પ. વિ. તે.	તે-તેઓ.
ભી. „, તેને.	તેને-તેઓને.
તી. „, તેણે.	તેણે-તેઓએ.
ચો. „, તેને ( માટે, સારુ ).	તેને-તેઓને.
પાં. „, તેથી-થકી.	તેથીથી-થકી.
છ. „, તેનો-ની-નું-ના-નાં.	તેનો-ની-નું-ના-નાં.
	તેઓનો-ની-નું-ના-નાં.
સા. „, તેમાં-તેનામાં.	તેમાં-તેમનામાં-તેઓનામાં.
‘નો’ અને ‘એ’નાં ઇપ ઉપર પ્રમાણે કરવાં.	

પોતે.

એકવચન

અને

અહુવચન.

પ. વિ.	પોતે.
ભી. „,	પોતાને.
તી. „,	પોતે.
ચો. „,	પોતાને ( માટે, સારુ ).
પાં. „,	પોતાથી-થકી.
છ. „,	પોતાનો-ની-નું-ના-નાં.
સા. „,	પોતામાં.

કોણુ.

એકુવચન.      બહુવચન.

૫.	નિ.	કોણુ.
બી.	„	કોને.૧
ની.	„	કોન્સુ.૨
ચો.	„	કોને.૩ ( માટે, સાર ).
પાં.	„	કોનાથી-થકી.૪
છ.	„	કોને-ની-નું-ના-નાં.૫
સા.	„	કોનામાં.૬

અકર્મક અને સકર્મક કિયાપદ.

‘લાકડુ સળગે છે,’ ‘મગનલાલ હસે છે,’ ‘દોઢો ઉછળ્યો,’ આ વાક્યોમાં કિયાનો અર્થ પુરેપુરો સમજય છે. આમાં કિયાનું પૂરક એટલે કર્મ નથી.

‘સળગે છે,’ ‘હસે છે,’ ‘ઉછળ્યો,’ અને આવાં ખીંચ કિયાપદો કર્મ વિનાનાં એટલે ‘અકર્મક’ છે.

અકર્મક-( અ+કર્મન+ક. ). જેને કર્મ નથી તે. ‘દેવડત ચોખા રાંધે છે,’ ‘ભિખારી રોટલો ખાય છે,’ ‘મેં તેને દક્ષિણા આપી,’ આ વાક્યોમાં ‘રાંધે છે,’ ‘ખાય છે,’ અને ‘આપી’ એ કિયા છે, અને ‘ચોખા,’ ‘રોટલો,’ અને ‘તેને દક્ષિણા’ એ કર્મ છે.

- |   |   |
|---|---|
| ૧. કને, કોણુને.<br>૨. કુણુ.<br>૩. કને—કોણુને.<br>૪. કોણુથી-થકી, કેનાથી-થકી.<br>૫. કને—ની—નું—ના—નાં.<br>૬. કેનામાં, કોણુમાં, કેમાં. | }<br>આવાં રૂપો પણ કોઈ<br>કોઈ રૂપો વપરાય છે. |
|---|---|

**સર્કરી - ( સ+કર્મન+ક ). જેને કર્મ હોય તો.**

**પ્રધાન અને ગૌણુ કર્મ.**

‘શિક્ષકે શિષ્યને પ્રશ્ન પૂછ્યો,’ ‘માટે છોકરાને વાત કહી,’ આ બંને વાક્યોમાં કિયાપદને એ કર્મ છે. ‘રિષ્યને,’ અને ‘પ્રશ્ન,’ એ ‘પૂછ્યો’ કિયાપદનાં, અને ‘છોકરાને,’ અને ‘વાત’ એ ‘કહી’ કિયાપદનાં કર્મ છે. આવાં કિયાપદો ‘દ્વિકર્મક’ — ( એ કર્મવાળાં ) કહેવાય છે. આ એ કર્મભાંથી એક ‘પ્રધાન’ અને બીજું ‘ગૌણુ’ છે. જેના ઉપર પૂછવાની અને કહેવાની કિયા લાગુ પાડી છે તે ‘ગૌણુ’ અને ને પૂછયું અને કહ્યું છે તે ‘પ્રધાન’ કર્મ.

---

**કર્તા અને ઉદ્દેશ્ય.**

‘મગનલાલ દોડે છે,’ ‘કુતરો ભસે છે,’ આ વાક્યોમાં ‘મગનલાલ’ અને ‘કુતરો’ કિયાના કરનાર એટલે કર્તા છે. ‘મગનલાલ’ અને ‘કુતરો’ ને ઉદ્દેશને કહેવામાં આવ્યું છે, માટે તે બંને નામો ‘ઉદ્દેશ્ય’ પણ છે. ‘મારાથી ચોપડી લખાઈ,’ ‘તમારાથી કાગળ વંચાયો,’ ‘તેનાથી નુકસાન કરાયું’ આ વાક્યોમાં ‘ચોપડી,’ ‘કાગળ,’ અને ‘નુકસાન’ થી કંઈ પણ કિયા થતી નથી, એટલે તે નામો કર્તા કે કિયાનાં કરનાર નથી. ‘ચોપડી,’ ‘કાગળ,’ અને ‘નુકસાન’ ને ઉદ્દેશને ‘લખાઈ,’ ‘વંચાયો,’ અને ‘કરાયું’ એ પ્રભાષે કહેવામાં આવ્યું છે, માટે તે નશે નામો ‘ઉદ્દેશ્ય’ કહેવાય. કર્તા ઉદ્દેશ્ય હોય, પણ દેખેક ઉદ્દેશ્ય કર્તા નથી.

## કાળ.

કિયાપદોનાં રૂપો ઉપરથી અમુક કિયા થાય છે એવું ભાન થાય છે, એટલંજ નહિ પણ ક્યારે થાય છે તે પણ જણ્ણાય છે. ‘હું કાગળ લખું છું,’ અહીં ‘લખું છું’ રૂપ ઉપરથી લખવાની કિયા ચાલુ છે એવું સ્પષ્ટ સમજાય છે.

‘મેં કાગળ લખ્યો,’ અહીં ‘લખ્યો’ રૂપ ઉપરથી લખવાની કિયા થઈ ગઈ છે એવું, અને ‘હું કાગળ લખીશ,’ એમાં ‘લખીશ’ રૂપ ઉપરથી લખવાની કિયા હજુ થવાની છે એવું સ્પષ્ટ સમજાય છે. કાળ એટલે વખત; અમુક કિયા થાય છે, થઈ ગઈ છે, કે થવાની છે, એ કિયા-પદના ‘કાળ’ ઉપરથી જણ્ણાય છે,

## વર્તમાન\* કાળ.

‘બાળક કાગળ ઝડપે છે,’ ‘વાંદરો ઝૂદે છે,’ ‘સુરજ જગે છે,’ આ વાક્યોમાં કિયાપદનાં રૂપ ઉપરથી જણ્ણાય છે કે કિયા ચાલુ છે.

વર્તમાન એટલે ચાલુ કે ચાલતો; ચાલતો વખત બતાવનાર કિયાપદ વર્તમાન કાળમાં કહેવાય છે.

## ભૂત કાળ.

‘સુરજ આથભ્યો,’ ‘ચંદ્ર જિગ્યો,’ ‘અજવાળું થયું,’ આ વાક્યોમાં કિયા થઈ ગઈ છે એવું સમજાય છે. ભૂત એટલે થઈ ગયેલો; થઈ ગયેલો વખત બતાવનાર કિયાપદ ભૂતકાળમાં કહેવાય છે.

---

\* ‘વર્તમાન,’ અને ‘વર્તમાન,’ ‘કર્તા,’ અને ‘કર્તા,’ વગેરે બંને રૂપો થાય છે,

### ભવિષ્ય કાળ.

‘વાળં વાગશે,’ ‘વરધોડા નીકળશે,’ ‘ગમત પડશે,’ આ વાક્યોમાં બધી કિયા હવે પછી થવાની છે એ કિયાપદનાં ઈપો ઉપરથા ખુલ્ખું છે.

ભવિષ્ય એટલે થવાનો કે આવવાનો; આવવાનો વખત બતાવનાર કિયાપદ ભવિષ્ય કાળમાં ફણેવાય છે.

‘પડ’ ધાતુનાં ત્રણે કાળનાં ઈપો.

### વર્તમાન કાળ.

નર, નારી, અને નાન્યતર જાતિ.

#### એકુલચન.

પહેલો મુરુષ. તું પડું છું. અમે પડીએ છીએ.

ભીજો „ તું પડે છે. તમે પડો છો.

ગીજો „ તે પડે છે. તેઓ પડે છે.

### ભૂત કાળ (ત્રણે પુરુષમાં).

#### એકુલચન.

નર જાતિ પડ્યો.

નારી જાતિ.

નાન્યતર જાતિ પડ્યું.

#### બહુલચન.

પડ્યા.

પડ્યાં.

પડ્યાં.

## ભવિષ્ય કાળો.

નર, નારી, અને નાન્યતરે.

એકવચન.

અહુવચન.

પહેલો	પુરુષ.	પરીથ.	પરીથું.
-------	--------	-------	---------

બીજો	„	પરીથ, પરો.	પરોણા.
------	---	------------	--------

ત્રીજો	„	પરો.	પરો.
--------	---	------	------

---

‘છ’ ધાતુનાં રૂપો.

## વર્તમાન કાળો.

એકવચન.

અહુવચન.

પહેલો	પું	હું છું.	અમે છીએ.
-------	-----	----------	----------

બીજો	પું	તું છે, છું.	તમે છો.
------	-----	--------------	---------

ત્રીજો	પું	તે છે.	તેઓ છે.
--------	-----	--------	---------

આ કિયાપદનાં વર્તમાન કાળ સિવાયનાં બીજા કાળનાં રૂપો થતો નથી. બીજા કાળમાં ‘છ’ ને બદલે ‘હો’ ધાતુ વપરાય છે.

---

અર્થ.

નિશ્ચયાર્થ.

‘હું લખું છું’ ‘તમે લખું,’ ‘તે કરો,’ ‘અમે કરેલું છે,’ ‘તે કરવાનો છે,’ આ બધાં વાક્યોમાં કિયાપદ નિશ્ચય બતાવે છે.

### સંશાયાર્થ.

‘હું હોડિં,’ ‘તમે કર્યું હોય,’ ‘તેણે કર્યું હુશી,’ ‘જે તું જાત તો સાંચ થાત,’ આ વાક્યોમાં કિયાપદનાં ઝેપો નક્કીપણું બતાવનાં નથી, પણ સંશય કે સંક્રિત બતાવે છે.

### આજાર્થ.

‘જાઓ,’ ‘તું કર,’ ‘પધારલો,’ ‘પરમેશ્વર તમાંથી ભલું કરો,’ ‘છોકરાંચોએ માભાપની આજા પાળવી,’ આ વાક્યોમાંનાં કિયાપદનાં ઝેપો ઉપરથી આજા, ઉપરેશ, આશાવાદ, પ્રાર્થના, વગેરેતું ભાન થાય છે.

નિશ્ચય, સંશય, કે આજાનો અર્થ બતાવનાર કિયાપદના રૂપને કિયાપદનો તે તે ‘અર્થ’ કહે છે.

---

### પ્રયોગ.

‘કરું છું,’ ‘કરો છો,’ ‘કરે છે,’ એ ઝેપો ઉપરથી કર્તાનું ભાન થાય છે. ‘કરાય છે,’ ‘ગવાય છે,’ એ ઝેપો ઉપરથી કર્તાનું નહિ પણ કર્મનું ભાન થાય છે.

### કર્તારિ પ્રયોગ.

‘કરું છું,’ ‘મોતીલાલ જય છે,’ ‘હું ચોપડો, કવિતા, કે ગીત લખું છું,’ અહીં વપરાએલાં કિયાપદનાં ઝેપો કર્તાનો ઓધ કરે છે. પ્રયોગ એટલે વપરાશ.

કિયાપદનો કર્તાના અર્થમાં વપરાશ હોય, ત્યારે  
તેનો પ્રયોગ કર્તારિ (કર્તાના અર્થમાં) કહેવાય.

### કર્મણી પ્રયોગ.

‘કરાયો,’ ‘લખાયું,’ ‘કરાશે,’ ‘મેં ચોપડો  
લખ્યો,’ ‘મારાથી ચોપડી લખાઈ,’ અહીં બધાં કિયા-  
પદ્ધાનાં રૂપો કર્મનો ઓધ કરે છે; એટલે તેનાં જતિ વચન,  
અને પુરષ કર્મ પ્રમાણે કરે છે.

કિયાપદનો કર્મના અર્થમાં વપરાશ હોય, ત્યારે  
તેનો પ્રયોગ (વપરાશ) કર્મણી (કર્મના અર્થમાં)  
કહેવાય.

### ભાવે પ્રયોગ.

‘જવાય છે,’ (જવાનું કે જવું થાય છે) ‘મને ગમે  
છે,’ ‘તમને ભાવતું નથી,’ આ બધાં કિયાપદોનાં રૂપો  
ઉપરથી કર્તાં કે કર્મનો ઓધ થતો નથી, માત્ર કિયાનો  
અર્થ સમજાય છે.

ભાવે (ભાવના-કિયાના-અર્થમાં) પ્રયોગમાં કિયાપદ  
હુમેશાં ત્રીજો પુરુષ, નાન્યતર જતિ, અને એકવચનમાં  
આવે છે.

‘પ્રયોગ’ શોધી કાઢવા માટે એક સરળ યુક્તિ નીચે  
પ્રમાણે છે.

કિયાપદનાં રૂપો કર્તા પ્રમાણે, કર્મ પ્રમાણે, કે  
ભાવ પ્રમાણે કરે છે તે શોધી કાઢવું.

‘છાકડો ગયો,’ પણ ‘છાકડી ગઈ,’ ‘છાકડે ગયું,’

આમાં કિયાપદનાં રૂપો કર્તાના ઇરવાથી ઇરે છે, માટે પ્રયોગ કર્તારિ છે.

‘મેં રોટલો ખાયો,’ પણ ‘મેં ભગડળો ખાધી,’  
‘જમદળ ખાધું,’ અહીં કિયાપદનાં રૂપો કર્મ પ્રમાણે ઇરે છે, માટે પ્રયોગ કર્મણિ.

‘પેટમાં દુઃખે છે,’ ‘મને અહીં દ્વાવતું નથી,’ અહીં કિયાપદનાં રૂપો કર્તા કે કર્મ એમાંથી એક પ્રમાણે ઇરતાં નથી.

જે શબ્દ પ્રમાણે કિયાપદને જનિવચન લાગે તેને ‘કિયાનાથ’ (કિયાનો ધણી અર્થાત, કિયા ઉપર કાણું ધરાવનાર કે કિયાપદના રૂપને પોતા પ્રમાણે ઇરવનાર) કહે છે.

### ધાતુ એઠલે શું ?

‘આપે છે,’ ‘આપતો,’ ‘આપવું,’ ‘આપેલું,’  
‘અપાયું,’ ‘અપાશો’ આ બધાનું મૂળ ‘આપ’ છે;  
તેમજ લખ્યું, લખતો, લખશે, લખેલું, વગેરેમાં ‘લખ’  
એ મૂળ છે.

જે મૂળ ઉપરથી કિયાપદનાં જુદાં જુદાં રૂપ  
થાય છે તે મૂળનું નામ ‘ધાતુ.’

મૂળ ધાતુ અને સાધિત ધાતુ.

‘કર,’ ‘લખ,’ ‘રમ,’ ‘પડ,’ વગેરે ‘મૂળ ધાતુ’  
કહેવાય છે. આ ધાતુને પ્રત્યય લાગવાથી જે રૂપો થાય

જે તેને ‘સાધિત ધાતુ’ કહે છે:—જે મને, ‘કરાવ,’ ‘રમાડ,’ ‘પાડ.’ વગેરે.

‘પાડ,’ ‘કરાવ,’ ‘લખાવ,’ વગેરે ‘પ્રેરક કે પ્રયોગ્ય’ ધાતુ કહેવાય છે. ‘કરાવરાવ,’ ‘લખાવરાવ,’ વગેરે ઇપો એવાં પ્રેરક કે પ્રયોગ્ય છે. મૂળ ધાતુ ઉપરથી જેટાં ઇપો થાય છે લેટાં પ્રયોગ્ય ધાતુ ઉપરથી પણ થાય છે:—જે મને ‘ચાલું છું,’ ‘ચલાલું છું,’ ‘ચાલ્યો,’ ‘ચલાલ્યો,’ ‘ચાલીથ,’ ‘ચલાવીશ,’ ‘ચાલતો,’ ‘ચલાવતો,’ વગેરે.

મૂળ ધાતુ\* —કર્તારિ .—‘હું કામ કરું છું.’

પ્રયોગ્ય ધાતુ—,, —‘હું કામ કરાલું છું.’

મૂળ ધાતુ—કર્મણુ—‘મેં કામ કર્યું.’

‘મારાથી કામ કરાયું.’

પ્રયોગ્ય ધાતુ—કર્મણુ—‘મેં કામ કરાવ્યું.’

‘મારાથી કામ કરાવાયું.’

\* ‘મૂળભેદ,’ ‘પ્રેરભેદ,’ એ પ્રમાણે ડિચાપદના ભેદ પાડવાની જરૂર નથી; કારણ કે ઉપરના દાખલાથી સમલાંશો કે જેને ‘મૂળભેદ’ કહેવામાં આવે છે તે ‘મૂળ ધાતુ’ છે, અને ‘પ્રેરભેદ’ તે ‘પ્રેરક કે પ્રયોગ્ય ધાતુ’ છે. જેને ‘સલભેદ’ કહે છે તે કર્તારિ રૂપના છે, અને જેને ‘સલભેદ’ કહે છે તે ‘કર્મણુ’ કે ભાવે રૂપના છે. સહૃદાતા, શિક્ષયતા, યોગ્યતા, વગેરે જે અયો સહભેદને ખાળું પડિલા છે તેનો ‘કર્મણુ’ રૂપનામાં સુભાવેણુ થાય છે.

મૂળ ધાતુ— ભાવે— ‘મારાથી બેસાયું.’

પ્રયોગ્ય ,,— કર્મણુ— ‘મારાથી નંગ બેસાડાયું.’

, „,— ભાવે. ‘મારાથી તેને મરાવાયું નહિં’

### કિયાપદના પદચેદના નમુના.

૧. છગન રડે છે.

‘૨૩ છે’ અકર્મક કિયાપદ, ‘૨૫’ ધાતુ, વર્તમાન કાળ, નિશ્ચયાર્થ, કર્તા ‘છગન,’ કિયાનાથ કર્તા, ત્રીજે પુરુષ, નર જલ્લિ, એકવચન, અકર્મક કર્તરિ પ્રયોગ.

૨. એન ગીત ગાય છે.

‘ગાય છે.’ સકર્મક કિયાપદ, ‘ગા’ ધાતુ, વર્તમાન કાળ, નિશ્ચયાર્થ કર્તા ‘એન,’ કર્મ ‘ગીત,’ કિયાનાથ ‘એન,’ ત્રીજે પુરુષ, નારી જલ્લિ, એકવચન, સકર્મક કર્તરિ પ્રયોગ.

૩. લલીતા પાઠ શીખી.

‘શીખી.’ સકર્મક કિયાપદ, ‘શીખ’ ધાતુ, ભૂત કાળ, નિશ્ચયાર્થ, કર્તા ‘લલીતા,’ કર્મ ‘પાઠ,’ કિયાનાથ કર્તા, ત્રીજે પુરુષ, નારી જલ્લિ, એકવચન, સકર્મક કર્તરિ પ્રયોગ.

૪. ભાઈએ ગીત ગાયું.

‘ગાયું.’ સકર્મક કિયાપદ, ‘ગા’ ધાતુ, ભૂત કાળ, નિશ્ચયાર્થ, કર્તા ‘ભાઈએ,’ (કર્તૃવાચક ત્રીજુ) કર્મ ‘ગીત,’ કિયાનાથ ગીત, ત્રીજે પુરુષ, નાન્યનર જલ્લિ, એકવચન, સકર્મક કર્મણુ પ્રયોગ.

૫. મારથી ચોપડી લખાઈ.

‘લખાઈ’ સકર્મક કિયાપદ, લખ ધાતુ, ભૂત કાળ, નિશ્ચયાર્થ, કર્તા ‘મારથી,’ કિયાનાથ ચોપડી, ત્રીજે પું, નારી જાતિ, એકવચન, સકર્મક કર્મણુ પ્રયોગ.

૬. અમે કામ કરાવીએ છીએ.

‘કરાવીએ છીએ.’ સકર્મક કિયાપદ, ‘કર’ ધાતુનું પ્રયોગ્ય રૂપ, વર્તમાન કાળ, નિશ્ચયાર્થ, કર્તા ‘અમે,’ કર્મ ‘કામ,’ કિયાનાથ કર્તા, પહેલો પું, તર જાતિ બહુવચન, સકર્મક કર્તરિ પ્રયોગ.

૭. કડીઆથી લીત પડાવરાવાઈ.

‘પડાવરાવાઈ.’ સકર્મક કિયાપદ, ‘પડ’ ધાતુનું દ્વિત્વ (ઐવહું) પ્રયોગ્ય રૂપ, ભૂત કાળ, નિશ્ચયાર્થ, કર્તા ‘કડીઆથી’ કિયાનાથ ‘લીત’, ત્રીજે પું, નારી જાતિ, એકવચન, સકર્મક કર્મણુ પ્રયોગ.

૮. મને અહીં ગમશે.

‘ગમશે.’ અકર્મક કિયાપદ, ‘ગમ’ ધાતુ, ભવિષ્ય કાળ, નિશ્ચયાર્થ, કર્તા કિયાનો લાવ, કિયાનાથ ભાવ, ત્રીજે પું, નાન્યતર જાતિ, એકવચન લાવે પ્રયોગ.

અત્યારે સુધી સાદામાં સાદા ‘ઉદ્દેશ્ય’ વિશે કહ્યું છે. ‘રાજ જય છે,’ ‘બિલાડીએ ઉદ્દરને પકડ્યો,’ આ એ વાક્યમાં ‘રાજ,’ અને ‘બિલાડીએ’ એ બને શર્ષ્ટો સાદા ઉદ્દેશ્ય છે.

**ઉદેશ્ય** ( ઉદ્ + દિશ + ય ) એટસે જેને ઉદેશીને  
કે અનમાં આણીને કહેવામાં આવ્યું હોય તે.

ઉપરનાં બંને વાક્યોને 'પરોપકારી રાજ જાય છે,'  
'ધોળા બિલાડીએ ઉદ્દરને પકડ્યો,' એ પ્રમાણે ઇરની  
બોલવાથી સમજાય છે, કે ઉદેશ્ય 'રાજ,' અને 'બિલાડી,'  
સાથે વધારાના શબ્દો 'પરોપકારી,' અને 'ધોળા,' ઉમે-  
રવામાં આવ્યા છે.

આ વધારાના શબ્દો ઉદેશ્યવર્ધક કહેવાય છે.  
'ઉદેશ્ય,' અને 'ઉદેશ્યવર્ધક' મળા 'ઉદેશ્યપક્ષ' બંને છે.  
'પરોપકારી રાજ,' અને 'ધોળા બિલાડીએ,' એ ઉદેશ્ય-  
પક્ષ' કહેવાય.


'પરોપકારી રાજ જાય છે,' 'ધોળા બિલાડીએ  
ઉદ્દરને પકડ્યો,' 'તે ગાડો થઈ ગયો,' 'રાજએ તેને  
પ્રધાન નીમ્યો,' આ વાક્યોમાં 'જાય છે,' 'પકડ્યો,'  
'થઈ ગયો,' અને 'નીમ્યો,' એ કિયા છે, અને 'ઉદ્દરને,'  
'ગાડો,' અને 'તેને પ્રધાન' એ કિયાપૂરક છે.  
'ધોળા બિલાડી,' 'તે,' અને 'રાજ,' વિષે શું કહ્યું છે?  
'ઉદ્દરને પકડ્યો,' 'ગાડો થઈ ગયો,' અને 'તેને પ્રધાન  
નીમ્યો,' એ પ્રમાણે કહ્યું છે, માટે તે 'વિધ્ય' છે.

**વિધ્ય** ( વિ + ધા + ય ) એટસે કહેવા ચોંચ્ય;  
ઉદેશ્યને વિષે ને કાંઈ કહેવું હોય તે. 'તે ગાડો થઈ ગયો,'  
આ વાક્યમાં 'ગાડો' કિયાનો અર્થ પુરી કરે છે, માટે  
તે 'કિયાપૂરક' છે, પણ તે 'કર્મ' નથી. બિલાડીએ  
ઉદ્દરને પકડ્યો,' એમાં ઉદ્ર' શબ્દ કિયાપૂરક, કર્મ છે.  
દ્રેક કર્મ કિયાપૂરક છે, પણ દ્રેક કિયાપૂરક કર્મ નથી, એ  
ઉપરના ફાખલાથી સમજાય છે.

‘ધોળી બિલાડીએ ઉદ્દરને પકડ્યો,’ એમ કહેવાને બદલે ‘ધોળી બિલાડીએ રતે ધણી ઝડપથી ઉદ્દરને પકડ્યો,’ એમ કહેવાથી ‘વિધેય’માં કંઈક વધારો થાય છે. ‘રતે,’ અને ‘ધણી ઝડપથી,’ એ ‘વિધેય’ ના વધારાના શુભ્દો છે. તે ‘વિધેયવર્ધક’ કહેવાય છે.

‘વિધેય,’ અને ‘વિધેયવર્ધક’ મળી ‘વિધેયપક્ષ’ બને છે. ઉપરના વાક્યમાં ‘રતે ધણી ઝડપથી ઉદ્દરને પકડ્યો’ એ ‘વિધેયપક્ષ’ છે.

આટલા વિવેચન ઉપરથી વાક્યના જુદા ભાગ કેમ પાડવા તે સમજય છે. વાક્યનું પૃથકુરણ (પૃથક् + કરણ) કરવું એટલેજ વાક્યના ભાગ પાડી ભતાવવા.



વાક્ય.	ઉદ્દેશ્ય.	વિધેય.
૧. જાઓ.	તમે. (અધ્યાહાર)	જાઓ.
૨ પરમેશ્વર છે.	પરમેશ્વર.	છે.
૩. છાકરો ટોડતો નથી.	છાકરો.	ટોડતો નથી.

વाक्य.

ઉद्देश्यवर्णक.      ઉદ्दેશ.      વિધ્યા.      વિધ્યાર્થક.

કિં.      કિંપુરેક.

૪. છોકરે। રોટલી આચ છે.      છોકરે। આચ છે.      રોટલી.  
૫. એ અંધળા છોકરાએ આઠ એ અંધળા।  
૬. મોટી રોટલી આની।  
૭. આરા કાકાનો છોકરે અગન, આરા કાકાનો અગન.      આરા આગામા છોકરા છગનને છોકરે।  
આરા આગામા છોકરા છગનને છોકરે।  
ઓલાને છે.
૮. રોજ આહારને દક્ષિણા.      રોજ.      આપે છે.      દક્ષિણા (પ્રધાનકર્મ)  
આહારને (ગૌણકર્મ)  
દક્ષિણા (પ્રધાનકર્મ)  
વિદાન આહારને દક્ષિણા  
આપી.

પૂઠકરેણ.

૫૮

પુષ્ટકરણ.

વાક્ય.      ઉ. વો.      ઇ. વો.      ઉ.      બિ.      વિ. વો.

- |                              |         |          |                 |                   |
|------------------------------|---------|----------|-----------------|-------------------|
| ૧૮. શાલુ। દેવદત્ત ધરમાં નથી. | શાલું.  | દેવદત્ત. | નથી.*           | ક્રિ. પુ.         |
| ૧૯. મારો નાનો ભાઈ અમદા-      | મારો.   | નાનો.    | અધી. અખુતો નથી. | ધરમાં.            |
| વાડમાં અજુતો નથી.            |         |          |                 | X                 |
| ૨૦. વાં સારું નીવડણું.       | X       | વાં.     | નીવડણું.        | X                 |
| ૨૧. પહેરતું વર્ણ એશક અહુ     | પહેરતું | વર્ણ.    | નીવડણું.        | અહુ સારું.        |
| સારું નીવડણું.               |         |          |                 | X                 |
| ૨૨. તમે ગોડા આવ્યા.          | X       | તમે.     | આખ્યા.          | મોડા.             |
| ૨૩. તું આટલો અધ્યા વહેલો કુમ | X       | તું.     | જાખ છે.         | ( કાળદર્શક.)      |
| લાખ છે ?                     |         |          |                 | આપદો અધ્યા વહેલો. |
| ૨૪. તું આટલો અધ્યા વહેલો કુમ | X       | તું.     | જાખ છે.         | ( કાળદર્શક.)      |
| લાખ છે ?                     |         |          |                 | કુમ ( કારણદર્શક ) |

\* પૌંચ, થંડ, નીવડણ, રહેણ, અતાં, વગેરે અક્રમિક બિચારાની, ‘અપૂર્ણ વિચિચનાં’ એવાં જે હોય કહેવા ચોણે તે અહું નહિ દર્શાયાં છે. આવા કિયાપણો પહેલાં કેટલાં શાખદો આવે ત્યારેજ વિચિચન સંભળું થાય છે. આ પૂરક શાખદો નામ, વિશેષણ, કિયાવિશેષણ, ( કિયાં વિશેષણ ) બતેરે હોય છે.

પાંચમા વાક્યમાં ‘એ,’ અને આંધળા,’ એ શબ્દો ઉહેસ્યના વર્ધક છે, એ શબ્દો ‘છોકરા’ એ નામના અર્થમાં વિશેષ બતાવે છે, માટે ‘વિશેષણુ’ કહેવાય છે. આજ વાક્યમાં ‘આડ,’ અને ‘મોટી’ એ વિશેષણો ‘રોટલી’ ને કિયાપૂરક છે તેના વધારા તરીકે આવ્યાં છે.

ઉહેસ્ય કે કિયાપૂરકના વધારા તરીકે એક કે એકથી વધારે વિશેષણ આવે છે.

છુટ્ટી વાક્યમાં ‘મારા કાકાનો છોકરો,’ ઉહેસ્યના અને ‘મારા મામાના છોકરા,’ એ કિયાપૂરકના વર્ધક છે. આ વર્ધકમાં ‘મારા કાકાનો,’ અને ‘મારા મામાના,’ એ શબ્દો છુટ્ટી વિભક્તિમાં છે.

ઉહેસ્ય અને કિયાપૂરકના વધારા તરીકે છુટ્ટી વિભક્તિમાંનાં નામ કે સર્વેનામ આવે છે.

છુટ્ટી વાક્યમાં ‘છોકરો’ શબ્દ ‘મગન’ ઉહેસ્યના સમાનાર્થમાં છે, અને ‘છોકરા’ એ ‘છગન’ પૂરકના સમાનાર્થમાં છે.

ને નામો ઉહેસ્યના સમાનાર્થમાં વપરાએલાં હોય છે, તે તેનાં વર્ધક ગણાય છે, અને ને પૂરકના સમાનાર્થમાં છે તે પૂરકના વર્ધક ગણાય છે.

બારગા વાક્યમાં ‘એશક’ એ કિયાતું વિશેષણ છે, માટે ‘કિયાવિશેષણુ’ કહેવાય છે. ‘એશક’ વિધેયના વધારા તરીકે છે.

વિશેષણુ.

‘રાજ જય છે,’ અને ‘બિલાડીએ ઉદ્ધરને પકડયો,’  
પહેલા વાક્યમાં ઉદ્દેશ્ય ‘રાજ’ ની પહેલાં ‘પરોપકારી’  
શબ્દ ઉમેરવાથી રાજ કેવો છે એ સમજય છે.

ખીજ વાક્યોમાં ઉદ્દેશ્ય ‘બિલાડી’ પહેલાં ‘ઘોળા’  
શબ્દ ઉમેરવાથી અને ‘ઉદ્ધર’ કર્મની પહેલાં ‘એક’ ઉમે-  
રવાથી ‘કેવી’ બિલાડીએ ‘કેટસ્ત’ ઉદ્ધર પકડયા એ નક્કી  
થાય છે. આજ પ્રમાણે ‘એ છોકરા આવ્યા,’ ‘પાંચ ઝાડ  
પડ્યાં,’ ‘રાતી ગાય ચરે છે,’ ‘મોટા વાંદરા લડ્યા,’ આ  
પ્રમાણે કહેવાથી ‘છોકરા,’ અને ‘ઝાડ’ ની સંઘા, ‘ગાય,’  
અને ‘વાંદરા’ કેવા છે એ નક્કી સમજય છે. એ, પાંચ,  
રાતી, અને મોટા શબ્દો નામ પહેલાં આવી નામના અર્થની  
વિશેષ કે વધારે સમજણુ પાડે છે.

જે શબ્દો વસ્તુ કેવી, કેટલી છે, વગેરે વિશેષ  
સમજાવે છે તે ‘વિશેષણુ.’

‘છોકરા,’ ‘ઝાડ,’ ‘ગાય,’ અને ‘વાંદરા,’ ના  
અર્થમાં વિશેષ થાય છે, માટે એ ‘વિશેષય’ કહેવાય.  
‘તે ધણો ડાઢો છે,’ ને એક ઉચ્ચો પાણીદાર ઘોડા  
ખરીદ્યા. આ બંને વાક્યોમાં ‘ધણો ડાઢો,’ અને  
‘એક ઉચ્ચો પાણીદાર’ એ શબ્દો—વિશેષણુ—હિયાપૂરક  
છે. ‘રાજનો ઉચ્ચો સફેદ ભહેલ આકાશ સાથે વાતો કરે  
છે.’ અહીં ‘રાજનો ઉચ્ચો સફેદ’ ઉદ્દેશ્યધર્થક છે. ‘તે  
ધણો જલદી આવ્યો,’ આમાં ‘ધણો’ વિધેયવર્ધક છે.  
આ બધાં વાક્યો તપાસતાં જણાય છે, હે વિશેષણુ

કિયાપૂરક, ઉદ્દેશ્યવર્ધક, કે વિધેયવર્ધક તરીકે પણ  
આવે છે.

### વિશેષણના પ્રકાર.

#### સંખ્યાવાચક.

‘એ,’ ‘ચાર,’ ‘પચાસ,’ ‘સો,’ વગેરે સંખ્યા બતાવનારા વિશેષણ છે, માટે તે ‘સંખ્યાવાચક’ વિશેષણ કહેવાય છે.

#### ગુણવાચક.

‘ઉચ્ચો,’ ‘નીચો,’ ‘લાલ,’ ‘સફેદ,’ ‘સારો,’ વગેરે શબ્દો વરતુના ગુણ બતાવે છે. આવા શબ્દો ‘ગુણવાચક’ વિશેષણ કહેવાય છે.

#### વિકારી વિશેષણ.

‘સારો છોકરો,’ ‘સારા છોકરા,’ ‘સારી છોકરી,’ ‘સારાં છોકરાં,’ ‘સારે છોકરે,’ અહીં ગુણવાચક વિશેષણ ‘સારો’ માં વિશેષણના વિકાર-ફેરફાર-પ્રમાણે વિકાર થાય છે. આવાં વિશેપણો ‘વિકારી’ કહેવાય છે

#### અવિકારી વિશેષણ.

‘લાલ ધોડો,’ ‘લાલ ધોડા,’ ‘લાલ ધોડીઓ,’ ‘ધોડાને,’ ‘લાલ ધોડીએ,’ અહીં ગુણવાચક વિશેષણ ‘લાલ,’ વિશેષભાં ફેરફાર થવાથી ફરજું નથી. આવાં વિશેપણો ‘અવિકારી’ કહેવાય છે.

## વિધિવાચક વિશેષણ.

વિશેષણનો નામ સાથે સંબંધ હોય છે, એ ‘પરો-  
પકારી રાજ,’ ‘ધોળા બિવાડી,’ વગેરે દાખલા ઉપરથી  
સમજાય છે; પરન્તુ ‘તે સારો છે,’ ‘પૃથ્વી ગોળ છે,’  
‘તે પૈસાદાર થયો,’ આ વાક્યોનું પૃથક્કરણ કરીશું તો  
‘સારો છે,’ અને ‘ગોળ છે,’ એ ‘વિધેય’ થશે, અહીં  
વિશેષણ ‘વિધેય’ ના ભાગ છે, વિધિ અથવા વિધાન  
કહેનારા છે, માટે ‘વિધિવાચક’ કહેવાય છે.

## વિશેષણ તરીકે વપરાચેલાં સર્વનામ.

‘તમે શું ઓલ્યા ?’ અહીં ‘શું’ પ્રશ્નાર્થક સર્વનામ  
છે, પણ ‘તમે શું કામ કર્યું ?’ આમાં ‘શું’ પ્રશ્નાર્થક વિશે-  
પણ છે, ‘તેવું કામ મારાથી નહિ થાય,’ ‘તેથલું જોર  
તેનામાં નથી,’ ‘વહું જનવર આપણે કોઈ હિવસ જોયું  
નથી,’ આ વાક્યો તપાસતાં જણાય છે, કે ‘તેવું’  
‘તેથલું,’ અને ‘તેવહું,’ ‘કામ,’ ‘જોર,’ અને ‘જનવર,’  
શબ્દો સાથે આની તેના અર્થમાં કંઈક વધારો કરે છે, માટે  
તેવું, તેથલું, તેવહું, વગેરે વિશેષણ છે.

## અધ્યાત્મ.

### કંયાવિશેષણ અધ્યાત્મ.

૧. મહેતાળનો છોકરો ઉપર ચોપડી વાંચે છે.
૨. મારો ભાઈ ધણુ દોડ્યો.

૩. તમારી ભત્તાને ધીમે ધીમે ગાય છે.

આ વાક્યોના એ પક્ષ નીચે મુજબ થણો:—

ઉદ્દેશ્યપક્ષ.	વિધેયપક્ષ.
૧. અહેતાળનો છોકરો	ઉપર ચોપડી વાંચે છે.
૨. મારા ભાઈ	ધણું દોડ્યો.
૩. તમારી ભત્તાને	ધીમે ધીમે ગાય છે.

### વિધેયપક્ષ.

વિધેય.	વિધેયવર્ધક.
કિયા.	ઉપર.
વાંચે છે.	ધણું.
દોડ્યો.	ધીમે.
ગાય છે.	ધીમે ધીમે.
ચોપડી.	
x	
x	

‘ઉપર,’ ‘ધણું,’ અને ‘ધીમે ધીમે,’ એ વિધેય-વર્ધક છે, અને જુદી જુદી કિયાઓ કયાં, કુટલી, અને કુલી રીતે, થાય છે એ તે શખ્ષોથી રૂપે થાય છે.

‘ધોડો ધણો ધામો આલ્યો,’ ‘ગાડી ધણું ઉતાવળા ચાલી,’ આ વાક્યોમાં ‘ધણો ધામો,’ અને ‘ધણું ધામી’ એ પણ ‘વિધેયવર્ધક’ છે.

આ બધા ‘વિધેયવર્ધક’ ‘કિયાવિશેખણું’ કહેવાય

કે, કારણું કે તે શબ્દો કિયાપદનો ગુણું બતાવી, તેના અર્થમાં વધારો કરે છે, એટલે કિયા શી રીતે, કથાં, અને ડયારે થાય છે વગેરે સમજાવે છે.

‘તે જલદી દોડ્યો,’ ‘તે જલદી દોડી,’ ‘તે જલદી દોડ્યું,’ ‘જલદી’ કિયાવિશેષણ અવ્યય છે. ( અ = નહિ, અને વ્યય = ફેરફાર ) ‘જલદી’ શબ્દનું ઇપ બદલાયા વિના તેવું ને તેવું રહે છે, એટલે કે તેનું ઇપ વિભક્તિ, જાતિ, કે કાળદર્શક પ્રત્યયો સ્વીકારતું નથી. નક્કી, ખરીત, જરૂર, વગેરે આવા અવ્યયો છે.

‘છોકરો ધીમો ચાલ્યો,’ ‘છોકરી ધીમી ચાલી,’ ‘છોકરું ધીમું ચાલ્યું,’ અહીં ‘ધીમો,’ ‘ધીમી,’ અને ‘ધીમું,’ તેમજ તેના જેવા ભીજ કેટલાક શબ્દો કિયા-વિશેષણ અવ્યય છે; પરન્તુ અપવાદ તરીકે તેનાં ઇપો ‘કિયાનાથ’ ની જાતિ પ્રમાણે બદલાય છે.

‘તે ધીમેથી બોલ્યો,’ ‘એટલામાં તો તે બોલી બોલ્યો,’ આ વાક્યોમાં કિયાવિશેષણ અવ્યયને વિભક્તિના પ્રત્યયો લાગેલા છે. સાધારણ રીતે કિયાવિશેષણ અવ્યયને આવા પ્રત્યયો લાગતા નથી. ઉપરના તેમજ તેના જેવા ભીજ કેટલાક હાખલા અપવાદરૂપેજ છે.

### કિયાવિશેષણ અવ્યયના મુખ્ય પ્રકાર.

#### ૧. વખત હેખાડનારો.

અત્યારે, એટલામાં, ક્યારે, જ્યારે, ઝટ, ઝટપટ, નિત્ય, પરાર, પહોર, હમણા, વળી, ઓણુ, વગેરે.

### ૨. ડેકાંસુ બતાવનાર.

આમ, આગળ, અહીં, જ્યાં, ઉચે, ઉપર, ઝ્યાં, કહીં,  
ત્યાં, તળે, દૂર, નીચે, પણે, પાછળ, પાસે, બહાર, માંહે,  
સાથે, હેઠળ, વગેરે.

### ૩. રીત હેખાડનાર.

આમ, એમ, કેમ, જેમ, તેમ, હળવે, ધીમે, ધીમે-  
ધીમે, વગેરે.

### ૪. નકાર બતાવનાર.

ન, નહિ, ના, ના.

૫. ઉપર સિવાયના પીળા:-જેવાડે, જરા, હીક,  
યાંકુ, ભદ્રે, સારુ, વગેરે.

### નામશૈંગી અવ્યાપ.

કિયાવિશેપણું ‘વિધેયવર્ધક’ તરીકે આવે છે એ  
આગળ પૃથકુરણુદ્ધારા સમજાવ્યું છે.

૧. ધર પછવાડે ચોાર ઉલો હતો.

૨. ધોડે નિશાળ આગળ અટક્યો.

૩. તારા વિના કામ થશે નહિ.

૪. મારી પાસે આનો.

આ વાક્યોનું પૃથકુરણું કરવાથી જણાય છે, કે  
'ધર પછવાડે,' 'નિશાળ આગળ,' 'તારા વિના,'  
'મારી પાસે,' એ શાખદસભૂહ 'વિધેયવર્ધક' છે. 'ધર  
પછવાડે' અથવા 'ધરની પછવાડે,' 'નિશાળ આગળ'

અથવા ‘નિશાળની આગાગ’ એમ પણ ઐતી શક્ય.  
ઉપરનાં વાક્યોમાં વપરાએલા અવ્યયો ‘પછવડે,’  
‘આગાગ,’ ‘વિના,’ અને ‘પાસે’ અનુકૂળે ‘ધર,’  
‘નિશાળ,’ ‘તારા,’ અને ‘મારી,’ સાથે જોડાએલા છે.  
અવ્યય અને નામ, સર્વતામ, કે તેવા અર્થમાં વપરાએલા  
શબ્દો વચ્ચેનો સંખ્યા છટ્ઠી વિલક્ષિતના પ્રત્યયથી જણાય  
છે. આ પ્રત્યય હાજર હોય કે અધ્યાહાર પણ હોય.

‘વાંદરો છાપરા ઉપર એડો હતો,’ અને ‘વાંદરો  
છાપરા ઉપર છે,’ આ એ વાક્યો તપાસતાં જણાશે, કે  
પહેલા વાક્યમાં ‘છાપરા ઉપર’ વિધેયવર્ધક, છે અને  
ઝીજામાં ‘છાપરા ઉપર’ એ ‘છે’ અપૂર્ણવિધેયવાચક  
કિયાપણું ‘કિયાપૂરક’ છે. આટલા વિવેચન ઉપરથી એ  
મુખ્ય નિયમો નીકળે છે તે નીચે મુજબ:—

૧. જે અવ્યય નામને જોડાએસો હોય છે,  
તે ‘નામયોગી અવ્યય’ કહેવાય છે.

૨. નામયોગી અને નામયોગીથી બનેલો  
શાખદસમૂહ ધરે આગે ‘વિધેયવર્ધક’ તરીકે અને  
કંચિત્ ‘કિયાપૂરક’ તરીકે આવે છે.

### વાક્યના પ્રકાર.

અત્યાર સુધીમાં વાક્ય અને તેના જુદા જુદા ભાગ—  
ઉદ્દેશ્ય, ઉદ્દેશ્યવર્ધક, વિધેય (કિયા + કિયાપૂરક) અને  
વિધેયવર્ધક વિષે કહેવામાં આવ્યું છે. હવે ઝીજાં કેટલાંક  
વધારે વાક્યો તપાસીએ.

૧. ભગનલાલ વાર્તા કહે છે.
૨. છગનલાલ કહે છે, કે હું વાર્તા કહીશ નહિ.
૩. જો છગનલાલ નહિ કહે, તો હું કહીશ.
૪. તમે કહેજો, અથવા હું કહીશ.

પહેલા વાક્યમાં એકજ મુખ્ય મુદ્દા વિષે કહ્યું છે. આ વાક્યમાં એકજ કિયાપદ છે. આ અને આવાં બીજાં વાક્યોને ‘સાધાં કે શુદ્ધ’ વાક્ય કહેવામાં આવે છે. બીજા વાક્યમાં ‘કહે છે’ કિયાપદનું ‘હું વાર્તા કહીશ નહિ’ એ આપું વાક્ય કિયાપૂરક છે. ‘છગનલાલ.....કહીશ નહિ’ આ વાક્યમાં એ ઉદ્દેશ્ય અને એ કિયાપદ છે, એટલુંજ નહિ, પરન્તુ ‘છગનલાલ કહે છે,’ અને ‘હું વાર્તા કહીશ નહિ’ એ બંને વાક્યો સરખા અધિકારવાળાં નથી. ‘છગનલાલ કહે છે’ એ ‘મુખ્ય’ કે ‘પ્રધાન’ વાક્ય છે, ને ‘હું વાર્તા કહીશ નહિ’ એ તેના ઉપર આધાર રાખ-નાર કે ‘ગૌણુ’ વાક્ય છે. આજ પ્રમાણે તીજા વાક્યમાં ‘હું કહીશ’ એ પ્રધાન વાક્ય છે, અને ‘જો છગનલાલ નહિ કહે’ એ ‘ગૌણુ’ વાક્ય છે. બીજા અને તીજા વાક્યને અને તેવાં બીજાં વાક્યોને ‘મિશ્ર’ વાક્ય કહે છે ચોથું વાક્ય તપાસતાં જણાશે, કે તેમાં એ ઉદ્દેશ્ય અને એ કિયાપદ છે, પણ ‘તમે કહેજો,’ અને ‘હું કહીશ,’ એ બંને વાક્યો તદ્દન સ્વતંત્ર છે, એટલે એક વાક્યનો આધાર બીજા ઉપર બીલકુલ નથી. ચોથું વાક્ય તેમજ તેના જેવાં બીજાં વાક્યો ‘સંચુક્ત’ કહેવાય છે.

---

## ગૌણુ વાક્યોના પ્રકાર.

### નામ વાક્ય.

‘હરિલાલ કહે છે, કે હું બાગમાં જાઉ છું,’ ‘તે મોડી રાત સુધી ઉજગરો કરે છે, એ સારું નથી,’ પહેલા વાક્યમાં ‘હું બાગમાં જાઉ છું,’ અને બીજામાં ‘તે મોડી રાત સુધી ઉજગરો કરે છે,’ એ ગૌણુ વાક્યો છે. ‘હું બાગમાં જાઉ છું,’ એ ગૌણુ વાક્ય ‘કહે છે’ કિયાપદનું કિયાપૂરક, કર્મ છે; અને ‘તે મોડી નાન સુધી ઉજગરો કરે છે’ એ ગૌણુ વાક્ય ‘એ’ની સમાન વિલક્ષિતમાં છે. પહેલું ગૌણુ વાક્ય, જેમ કોઈ નામ (નામ કે તેને માટે વપરાયેલો શબ્દ) કિયાપદના કર્મ તરીકે આવે છે તેમ આવેલું છે, અને બીજું ગૌણુ વાક્ય સમાન વિલક્ષિતમાં આવેલા નામની પેડે વપરાયું છે.

જે ગૌણુ વાક્ય નામની પેડે વપરાય છે તેને ‘નામ વાક્ય’ કહે છે.

### વિશેષણુ વાક્ય.

‘જે માણસ કાલે આવ્યો હતો તે આજ છે,’ ‘તમે જે કહે છો તે હું સમજું છું,’ ‘જે માણસ કાલે આવ્યો હતો’ એ ગૌણુ વાક્ય ‘તે’નું વિશેષણુ છે, અને ‘તમે જે કહેા છો’ એ ગૌણુ વાક્ય ‘તે’નું વિશેષણુ છે

જે ગૌણુ વાક્ય વિશેષણુ તરીકે વપરાયું હોય તે ‘વિશેષણુ વાક્ય’ કહેવાય.

### કિયાવિશેષણું વાક્ય.

‘ જ્યાં તું જઈશ, ત્યાં હું આવીશ, ’ ‘ જ્યાંસુધી તું સાચું બોલશે નહિ, ત્યાંસુધી હું તને ચાહીશ નહિ, ’ આ વાક્યોમાં ‘ જ્યાં તું જઈશ, ’ અને ‘ જ્યાંસુધી તું સાચું બોલશે નહિ ’ એ ‘ ત્યાં, ’ અને ‘ લાંસુધી ’ કિયાવિશેષણ અવ્યયના વધારા તરીકે આવેલાં છે, માટે તે જૈણ વાક્યોને ‘ કિયાવિશેષણું વાક્યો ’ કહે છે.

**કિયાવિશેષણ તરીકે વપરામેલાં વાક્યો  
કિયાવિશેષણું વાક્યો કહેવાય છે.**

### વાક્યપૂરુષકરણના નમુના.

કેટલાંક વાક્યોનું પૃથક્કરણ ખુલાસા સાથે નમુના દાખલ આપ્યું છે. તેને અનુસરીને બીજાં વાક્યોનું પૃથક્કરણ કરવું.

૧. તે સહગૃહસ્થ છે એ નિઃસંશય છે.
૨. તે આટલો બધો જલદી કેમ જતો રહ્યો, એ હું જાણુતો નથી.
૩. વિધવાનું લગ્ન સરાસ્ર છે એમ કેટલાક ભાને છે.
૪. જેમને ઉંડા ઉતરી વિચાર કરવાની ટેવ છે, તે આ ગહન વિષય સમજી શકશે.

૫. જ્યારે હું અદ્યપરા પુરુષ હાથીના જેવો મદાંધ હતો, ત્યારે હું સર્વજ હું એમ મારું મન ગર્વિષ હતું; પણ જ્યારે કિંચિત્ કિંચિત્ બુધજ્ઞન પાસેથી મેં પ્રામ કર્યું, ત્યારે હું ભર્ખ હું એમ મારો મદ જવરની પેઠે જતો રહ્યો.



વાક્ય.      પ્રકાર.      ઉદ્દેશ્ય.      બીજુથિતીક.      વિધિય.      નિર્ધિયકીક.

વિધવાનું...સશાસ્ત્ર  
નામ વાક્ય.      પુનર્લભા.  
આને છે.      કરે.  
કું એમની આશે  
સેમાન વલલિતમાં.

૫. જેમને...સમજ હાસ્ટે. મિશ્ર વાક્ય.  
જેમને...એવ સમજ આશે.      આ ગક્કાન અફજી (રીત-

જેમને=નેમની.      છે.      તું ઊરી  
જેમને....એવ છે.      વિશેષજી વાક્ય.  
જેમને....એવ તે.      વિશેષજી.

૬. જોહારે...જાતો રહ્યા.      સંયુક્ત વાક્ય.  
જોહારે....કર્તૃ.      મિશ્ર વાક્ય.      અન.      આં.      બર્દુ.  
જોહારે....એવ છે.      (રીતવાચક).

જોહારે....એવ  
અધાન્ય      હતો  
( કાળવાચક ).

જાસેથી,  
ખુમલન ચાસેથી,  
જાયારે.

વાસ્તુ  
બાસ્તુ.

કૃષ્ણ  
કૃષ્ણ.

અધ્ય.

(કાળાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

(અંતિમાંદિક).

વિશેષવિધિક.

પ્રાણ.  
ઉદ્દેશ.  
ઉદ્દેશવિધિક.

બાણ.

વાક્યપુથકરણુના નમુના.

### ઉભયાન્વયી અવધય.

‘તમે કહેજો અથવા હું કહીશ,’ એ સંયુક્ત વાક્યમાં ‘તમે કહેજો,’ અને ‘હું કહીશ,’ એ એ પ્રધાન વાક્યો ‘અથવા’ અવ્યયથી જોડાયેલાં છે. ‘તમે આવશો કે હું આવશી,’ ‘તમે ધડી ધડીમાં ગુસ્સે થાયો છો, પણ હું થતો નથી,’ ‘એક હતો ચકડો અને એક હતી ચકદી,’ અહીં ‘અથવા,’ ‘કે,’ ‘પણ,’ ને ‘અને,’ અવ્યય. યોથી સ્વતંત્ર વાક્યો જોડાયાં છે. ‘રામ અને લક્ષ્મણ,’ ‘રાવણ અને કુલકર્ણી,’ અહીં ‘અને’ અવ્યય એ વાક્યને નહિ પણ એ શાખણે જોડે છે.

જે અવ્યયો એ શાખણો કે વાક્યોને જોડે છે તેને ‘ઉભયાન્વયી’ ( ઉભય=એ શાખણ કે વાક્ય, અન્વયી=જોડનાર ) કહે છે. નીચેના શાખણો ઉભયાન્વયી અવ્યયો તરીકે વપરાય છે.

અથવા, તથા, અને, ને, કે, જે, વળી, વા, કિંબા, અગર, પણ, પરન્તુ, તથાપિ, છતાં, સામું, ઉલદું, કેમકે, માટે, તથી, નહિતો, વગેરે.

### વિલક્ષિત અને તેના ઉપયોગ.

#### પહેલી વિલક્ષિત.

પહેલી વિલક્ષિતનો અર્થ માત્ર ‘નિર્દેશ’ છે. નિર્દેશ એટલે શાખણ કહેવો તે.

પ્રથમાના અર્થ—નિર્દેશવાચકः—જેમકે,

૧. છાકરો નિશાળે જાય છે.

૨. મારાથી ચીપડી લખાઈ.

૩. તે રાજ થયો.

૪. સવાર થતાં લશકરે કૂચ કરી.

૨૦. પરિમાણવાચક પ્રથમાઃ—નેમકે,

૧. મેં પાલા ચોઆ લીધા.
૨. તેણે એક લોટો પાણી પીધું.

૩. સંખેધનાર્થે પ્રથમાઃ—નેમકે,

૧. હે મૂર્ખ, તે આ શું કર્યું?
૨. લાઈ, અહીં આવો.

#### બીજુ વિભક્તિ.

કર્મ એ બીજુ વિભક્તિનો મુખ્ય અર્થ છે; પરન્તુ એ કર્મ કિયાથી ઉકા-કહેવાએલું-ન હોય નેદીએ.

૧. મેં ચોપડી લખ્યો. ‘ચોપડી’ એ ખરી રીતે નિર્દેશવાચક પ્રથમાજ છે, પરન્તુ ગુજરાતીમાં આવે સ્થળે બીજુ વિભક્તિ કહેવી ઢીક છે, કારણ કે ‘મેં તેને માયો’ એવે સ્થળે કિયાપડું કર્મખિયું છે તોપણું કર્મ ગુજરાતીમાં બાજુ વિભક્તિમાં વપરાય છે, માટે ‘મેં ચોપડી લખ્યો’ એવે સ્થળે પણું ‘ચોપડી’ ને બીજુ ગણુંની સુતર પડશે.

૨. મેં તેને માયો.

૩. મેં તેને પ્રક્રિયા પૂછ્યો. પ્રક્રિયા = પ્રધાન કર્મ;

તેને = જીણું કર્મ.

કાળ અને સ્થળવાચક શાખાઓ બીજુમાં આવેઃ—નેમકે,

૧. તે આઠ કલાક ઉધ્યો.
૨. નદી એ ફોશા ફૂર છે.

#### ત્રીજુ વિભક્તિ.

‘કર્ત્તી,’ અને ‘કરણું’ એ ત્રીજુ વિભક્તિના મુખ્ય અર્થ છે. કિયા કરવામાં જે ધાર્યું મદદગાર તે ‘કરણું.’

૧. રામે બાણું વાલીને માયો.

૨. મેં તેને લાકડીએ માયો.

૨. તેણે તે કામ હુણ્યું કર્યું.

આ વાક્યોમાં ‘બાણું,’ ‘લાકડીએ,’ અને ‘હુણ્યું’ એ કરણવાચક તૃતીયામાં છે, કારણ કે બાણું, લાકડી, અને

હાથનાં સાધન વડે કિયાઓ કરવામાં આવી છે. 'રામે,' 'મી,' અને 'તેણે' એ કર્તવ્યાચક તૃતીનામાં છે, કારણ  
કે તે બધા કિયાના કરેનારા કે સાધનારા છે

હેતુવાચક નામ ત્રાળ વિલક્ષિતમાં આવે છે.

૧. ગર્વમાયે શરીર સુકાય છે.

૨. ટાઢે શરીર દ્વારે છે.

મૂલ્યવાચક પદ પણ ત્રીજામાં આવે છે.

૧. એ આને શેર. ૨. ચાર રૂપીએ મણું.

### ચોથી વિલક્ષિત.

'સંપ્રદાન' (આપવું) એ ચોથીનો મુખ્ય અર્થ છે.  
જેને કંઈ મળે છે કે આપવામાં આવે છે તેની ચોથી  
વિલક્ષિત કહેવાય.

૧. તેણે શુલ્ગને દૃક્ષિણા આપી.

૨. મૈં આદ્ધારણને દાન દીધું.

૩. છાકરે પિતાને પત્ર મોકલ્યો.

૧. મને તે ચીજ ગમે છે.

૨. તેને તે બાબત સુયતી નથી.

૩. અમને ત્યાં જરૂર હીક લાગ્યું નહિં.

અહીં 'મને,' 'તેને,' અને 'અમને' ની ચોથી

### વિલક્ષિત કહેવાય.

'કાને,' 'અંથે,' 'સારુ,' 'માટે,' એવા શબ્દો  
ને નામ સાથે વપરાયા હોય, તે ખરું જોઈએ તો ચતુર્થી.  
માંજ છે; પરન્તુ 'માટે,' 'અંથે,' 'સારુ,' એ નામયોગી  
અવ્યયો છે, માટે 'મુક્તિ માટે' તેમાં 'મુક્તિ'ને છૂટી  
વિલક્ષિત કહેવી; પરન્તુ 'મુક્તિ માટે' એ શબ્દસમુદ્દાય  
ચતુર્થીમાં કહેવાય.

જ્યારે ‘કાણે,’ ‘અથે,’ ‘માટે,’ ‘સારુ,’ નેવા શબ્દ ન હોય પણ ‘તેને માટે’ એવો અર્થ હોય, ત્યારે અતુધીજ લેવીઃ—નેમકે,

### ૧. લડવાને તૈયાર થાઓ.

આમ કહેવાને બદલે ‘લડવાને માટે તૈયાર થાઓ’ એમ કહું હોય તો ‘લડવાને’ છુટી વિલક્ષિતમાં ગણ્ય અને ‘માટે’ નામયોગી અવ્યય કહેવાય.

### પંચમી.

‘અપાદાન’ (કાઈનાથી છુટા પરંબું) એ પંચમીનો સુખ્ય અર્થ છેઃ—નેમકે,

૧. તે ગામથી નીકળ્યો.
૨. અગાસીથી પડ્યો.
૩. વૃક્ષથી પાંડાં પડે છે.

‘ધોડા ઉપરથી પડ્યો,’ અહીં ‘ઉપરથી’ નામયોગી અવ્યય છે, તેથી ‘ધોડા’ની છુટી વિલક્ષિત કહેવાય; પરંતુ ‘ધોડા ઉપરથી’ એ શબ્દસમુહાયને અપાદાનના અર્થમાં પંચમી કહેવાય.

હેતુવાયક શબ્દ પણ પંચમીમાં આવે છે.

૧. ગર્ભીથી પાણી સુકાય છે.
૨. દાઢથી પાણીનો બરક થઈ જાય છે.
૩. મર્યાદાવાયક પદ પંચમીમાં આવે છે.
૪. મહુનાથી માંદા છે.

### છુટી વિલક્ષિત.

‘સંખ્ય’ એ છુટીનો સુખ્ય અર્થ છે. ‘સંખ્ય’ શબ્દનો અર્થ ધરણો બહાળો છે.

૧. છોકરાની ચોપડી. અહીં ચોપડીનો ભાલીક છોકરો છે, મારે સંબંધ ભાલીકનો કહેવાય આજ પ્રમાણે નીચેનાં વાક્યોમાં જુદી જુદી જાતનો સંબંધ બતાવ્યો છે.

૨. રાજનો નોકર.
૩. ઝાડની ડાળી.
૪. સેનાતની કંઠી.
૫. સુરજનું તેજ.
૬. વડનું ઝાડ.
૭. ધીની કુપી.

છ્ટી વિભક્તિ સત્તમીના અર્થમાં પણ વપરાય છે:— જેમકે, ‘હિવસના સુલું, અને રાતના જગલું, એ કુદરતી નિયમ વિરુદ્ધ છે.’

### સાતમી વિભક્તિ.

‘અધિકરણુ’ (સ્થળ) એ સાતમીનો મુખ્ય અર્થ છે:— જેમકે, ‘તે નગરમાં વસે છે,’ ‘હું થાઈમાં જરૂર છું.’

### ત્રીજ અને સાતમી વિભક્તિ.

ત્રીજ અને સાતમી વિભક્તિમાં ‘એ’ પ્રત્યય સામાન્ય હોવાથી ગુંચવાડો ઉત્પન્ન થવાનો સંભવ છે. ‘એ’ પ્રત્યય ‘કરણુવાયક’ હોય તો તૃતીયા, અને ‘અધિકરણુવાયક’ હોય તો સત્તમી થાય છે.

૧. તે આ રર્સે વડોદરે ગયો.

રર્સે = કરણુવાયક તૃતીયા.

વડોદરે = અધિકરણુવાયક સત્તમી.

૨. આ રર્સે અહીં આવો.

રર્સે = તૃતીયા.

૩. ‘ રસ્તે ચાલ્યો. ’

રસ્તે = સમભી.

૪. તે જાડે ચઢ્યો.

જાડે = સમભી.

૫. તે આ ડાળીએ જાડે ચઢ્યો.

ડાળીએ = તૃતીયા.

જાડે = સમભી.

૬. તેને માથે પાધડી છે.

માથે = સમભી.

૭. તેણે માથે પોટલી ઉચકી છે.

માથે = તૃતીયા.

### કૃદંત. \*

‘ હું લખું છું ’ એમ બોલવાથી અર્થ સમજાય છે, પરન્તુ ‘ હું લખતો,’ ‘ હું લખીને,’ એ પ્રમાણે બોલવાથી વાક્ય બનતું નથી, અને બોલવાનો અર્થ પણ સમજાતો નથી.

‘કાગળ લખીને તેણે પોતાનું કામ ઉલદું બગાડ્યું,’ ‘છોકરાં હોડતાં પડી ગયાં’ આ વાક્યોનું પૃથક્કરણ કરતાં જણાશે, કે ‘લખીને,’ અને ‘હોડતાં,’ ‘વિષેયવર્ધક’ છે. ‘હોડતો ધોડો સુંદર હેખાય છે,’ ‘મે મરેલો સાપ જેયા’ પહેલા વાક્યમાં ‘હોડતો’ ઉદ્દેશ્યવર્ધક છે, અને ખીજનમાં ‘મરેલો’ કિયાપૂરક છે. ‘લખીને,’ ‘હોડતાં,’ ‘હોડતો,’ ‘મરેલો,’ એ શબ્દો ‘કૃદંત’ કહેવાય. મૂળ ધાતુ ‘લખ,’ ‘હોડ,’ અને ‘મર,’ને જુદા જુદા પ્રત્યે લગાડવાથી જુદાં જુદાં રૂપ ‘લખીને,’ ‘હોડતાં,’ ‘હોડતો,’ અને ‘મરેલો,’ થયાં છે. આજ પ્રમાણે ‘લખ,’ અને ‘લખ’ મૂળને જુદા

\* કૃત + અંત: ને શબ્દને અંતે ‘કૃત’ પ્રત્યે આવે છે તેને ‘કૃદંત’ કહે છે. કૃદંત અને કિયાપદમાં કેર અઠવો કે કિયાપદથી વાક્ય બને છે, કૃદંતથી વાક્ય બનતું નથી.

જુદી પ્રત્યયો લગાડવાથી 'લખી,' 'લખનાર,' 'લખતી,' 'લખવું.' વગેરે અને 'લખીને,' લખુતો,' 'લખેલો,' વગેરે 'કૃહંતો' અને છે.

ધાતુ ઉપર પ્રત્યય આવીને જે શબ્દો અને છે તેનું નામ 'કૃહંત.'

'હું કામ કરી કે કરીને આવીશ,' 'તે દોડનાં પડી ગઈ,' 'તે દોડનાં પડી ગયો,' તે દોડનાં પડી ગયું,' આ વાક્યોમાં 'કૃહંત,' વિધેયવર્ધક છે, અને કંઈ વિકાર પામતા નથી. આના કૃહંતોને 'કૃહંત અવ્યય' કહે છે.

'મેઝ ઉપર એક છાપેલી ચોપડી પડી હતી,' 'મેં એક દોડતી ધોડી જોઈ,' પહેલા વાક્યમાં 'છાપેલી' કૃહંત ઉદ્દેશ્યવર્ધક છે, અને નેના વિશેષણ તરીકે ઉપયોગ થયો છે. બોળમાં 'દોડતી' કૃહંત કિયાપૂરકનું વિશેષણ છે. આવી રીતે વપરાએલા કૃહંતોને 'કૃહંત વિશેષણ' કહે છે.

### કાળ પ્રમાણે કૃહંતના પ્રકાર.

'વર્ણમાન,' 'ભૂત,' અને 'ભનિષ્ય' એ શબ્દોની સમજુતી આપેલી છે. 'છાપેલું પુરતક,' 'શાટેલી ટોપી,' અહીં 'છાપેલું,' અને 'શાટેલી' કૃહંતો વિશેષભૂત કૃહંતો છે, કારણું કે કૃહંતના ઇપ ઉપરથી છાપવાની અને દોડવાની કિયા ધણ્ણા વખત પહેલાં થઈ ગયેલી સમજય છે. 'સાચું ઓલવું,' 'ઓઠાને ધિક્કારવું,' આમાં 'ઓલવું,' અને 'ધિક્કારવું' કૃહંતોને 'સામાન્ય કૃહંત' કહે છે, કારણું કે તે ઇપ ઉપરથી ચોકસ કાળનું ભાન થતું નથી. 'કરેનાર,' 'લખનાર,' એ 'કર્તૃવાચક કૃહંત' કહેવાય છે, કારણું એ કર્તાના અર્થમાં વપરાય છે. 'લખીને આવીશ' એ 'લખીશ અને આવીશ'નું કુંકું ઇપ છે. 'લખીને' કૃહંત લખવાની અને આવવાની કિયાનો સંબંધ જોડે છે, આટે તેને 'સંબંધક ભૂત કૃહંત' કહે છે.

କାନ୍ତିର ପାଦରେ ଶୁଣି ମୁଁ ଏହାର କାନ୍ତିର  
ପାଦରେ ଶୁଣି ମୁଁ ଏହାର କାନ୍ତିର

३

ପ୍ରକାଶକ

ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ପାଇଁ ଆଶ୍ରମ କରିବାକୁ ଅନୁରୋଧ କରିଛନ୍ତି।

四百

નારી. ના-નૂતર. તું. તાં. અં. થાં. વાન્ન. વાન્ન. અં. લાં. રં. વાં. નાન્ન. નારી. નારી.  
 તી. તી. પ્યા. વાની. વાની. લી. લી. વી. વી.  
 નર. તો. તા. એ. ચા. વાનો. વાના. લો. લા. વો. વા.  
 નાર-નારો. નાર-નારો. નારી. નારી.  
 { આમેક વધન. આહુવધન. આહુવધન. આહુવધન.  
 આમેક વધન. આહુવધન. આહુવધન. આહુવધન.  
 આમેક વધન. આહુવધન. આહુવધન. આહુવધન.  
 આમેક વધન. આહુવધન. આહુવધન. આહુવધન.

બાળ કેદીનું.  
સંભાવની  
કંદું.  
કંદું  
અન્યાન્ય.  
”  
વિશેષભાગ.  
એલાદ.  
શાન્દ.  
”  
બાળ.

‘ છુ,’ ‘ છુને,’ અને ‘ તાં,’ પ્રત્યાવાળા કૃહંત અવ્યા  
તરીકિ વપુરાય છે.

પ્રેરક અને કર્મણુ રચનામાં પણ કૃહંતનાં રૂપો થાય  
છે:—જેમકે,

મૂળ રૂપ.	} કર્તારિ—કરતો. કર્મણુ—કરાતો.
પ્રેરક રૂપ.	
} કર્તારિ—કરાવતો. કર્મણુ=કરાવાતો.	

### મિશ્રકાળ.

‘ વર્તમાન,’ ‘ ભૂત,’ અને ‘ ભવિષ્ય’ કાળ એ શુદ્ધ  
કાળ કહેવાય છે. શુદ્ધ કાળ બનાવવા માટે કિયાપદને  
અસુધી પ્રત્યે લગ્નાડવાની જરૂર પડે છે, પણ ‘ કર્યું હતું,’  
‘ કર્યું છે’ એવાં મિશ્રકાળનાં રૂપો બનાવવા સાહાયકારક  
કિયાપદની જરૂર પડે છે. ‘ હો,’ અને ‘ છ’ ધાતુ સાહા-  
યકારક છે. ‘ કરતો હતો,’ ‘ કર્યું છે,’ ‘ કરવાતું છે’  
અહીં ‘ હો,’ અને ‘ છ’ સાહાયકારક છે.

### મિશ્રકાળનાં રૂપો.

કરે છે\*=દ્વિત્વવર્તમાન કાળ.

કરતો હતો=વર્તમાનભૂત કાળ.

કર્યો છે=ભૂતવર્તમાન.

કર્યો હતો=દ્વિત્વભૂત.

કરવાતો છે=ભવિષ્યવર્તમાન.

કરવાતો હતો=ભવિષ્યભૂત.

કરલો છે=વિશેષભૂતવર્તમાન.

કરલો હતો=દ્વિત્વભિશેષભૂત.

\* કિયાપદના પદ્દચેદના નમુના ( પૃષ્ઠ ૩૨—૩૩ ) માં ‘ રૂડે  
છ’ વગેરેનો સ્થળતા ખાતર ‘ વર્તમાન કાળ ’ કહ્યો છે. નિશ્ચ-  
યાર્થ અને સંશોધિમાં ‘ રૂડે ’ એ ૩૫ શુદ્ધ વર્તમાન કાળનું ગણ્યાય.

સંયુક્ત કિયાપદ.

‘તેણે ઇન નાખી દીધું,’ ‘ચોર જતો રહ્યો,’  
 ‘તે બોલી ચૂક્યો,’ ‘તેણે ખાઈ દીધું,’ આ વાક્યો  
 તપાસતાં જણાય છે, કે ‘નાખી દીધું,’ ‘જતો રહ્યો,’  
 ‘બોલી ચૂક્યો,’ અને ‘ખાઈ દીધું,’ કિયાપદો બધ્યે  
 કિયાપદો સાથે મળી થશેલાં છે. આવાં કિયાપદો ‘સંયુક્તા’  
 કે જોડશેલાં કહેવાય છે. ‘નાખી દીધું’ એ કિયાપદમાં  
 નાખવાનો કે હેવાનો છુટો છુટો અર્થ નથી; પરન્તુ બંને  
 કિયાપદનો છુટો છુટો અર્થ જતો રહે છે, અને તેના જોડવાથી  
 કંઈ જુદોઝ અર્થ નીકળે છે. સંયુક્ત કિયાપદમાં પાછળ  
 આવનાર કિયાપદનો ભૂગ અર્થ જતો રહે છે, અને તે તેના  
 પહેલાં આવેલા કિયાપદના અર્થમાં ડોઈ પણ જતનો વધારો  
 કરી બતાવે છે. ‘બોલી ચૂક્યો’ કિયાપદમાં ‘ચૂક્યો’ નો  
 અર્થ છેજ નહિ; તે કિયાપદથી બોલવાની કિયા પરિપૂર્ણ થઈ  
 ગઈ છે એહિલુંજ સમજાય છે. સંયુક્ત કિયાપદો ધર્ષે ભાગે  
 જત જતના કૃદંતો અને ભીજાં કિયાપદો મળી થાય છે.

નથી.

‘રખડતો નથી,’ ‘બોલતા નથી,’ ‘બગડ્યું નથી,’  
 અહીં ‘નથી’ એ ‘છ’ સાલાય્યકારક ધાતુનું વર્તમાન  
 કાળનું નકારવાચક ઝેપ છે.

‘છ’ ધાતુના વર્તમાન કાળ સિવાય ભીજાં ઝેપો  
 થતાં નથી.

‘છ’ ધાતુ. વર્તમાન કાળ.

એકવચન. અહુવચન.

‘છ’	‘નથી’	
હું. હું.	હું નથી.	અમે છીએ. અમે નથી.
તું છે. હું.	તું નથી.	તમે છો. તમે નથી.
તે છે.	તે નથી.	તોઓ છો. તોઓ નથી.

‘કર્યું નહિ,’ ‘ન હોય,’ ‘ન હતું,’ ‘નહિ હશે,’ આ શાખા ઉપરથી સમજાય છે, કે ભૂત, અને ‘ભવિષ્ય’ કાળમાં ‘હો’ સાહાય્યકારક સાથે ‘ન,’ ના, અને ‘નહિ’ વપરાય છે.

આગાર્ય ઇપોની સાથે નકાર બતાવવા માટે ‘આ,’ ‘ન, ના,’ અને ‘નહિ’ વપરાય છે:-નેમકે, ‘કર મા,’ ‘ન કરીશું,’ ‘કરીશ ના,’ કે ‘ના કરીશ,’ અને કરીશ નહિ.’

### વિશેષણ વિષે વિશેષ વિચાર.

૧. દ્યાળુ રાજ જાય છે.
૨. ધણો દ્યાળુ રાજ જાય છે.
૩. બિલાડીનું બચ્ચું ચપળ છે.
૪. બિલાડીનું બચ્ચું ધણું ચપળ છે.
૫. તે જલદી આવ્યો.
૬. તે ધણો જલદી આવ્યો.

પહેલા વાક્યમાં ‘દ્યાળુ’ એ રાજનું વિશેષણ છે, પરન્તુ બીજા વાક્યમાં ‘દ્યાળુ’ પહેલાં ‘ધણો’ આવવાથી તેના અર્થમાં વિશેષ બતાવે છે, માટે ‘ધણો’ “વિશેષણ-નું વિશેષણ” કહેવાય.

ત્રીજા વાક્યમાં ‘ચપળ’ વિધિવાચક વિશેષણ છે, પરન્તુ ચોથા વાક્યમાં ‘ચપળ’ પહેલાં ‘ધણું’ આવવાથી તેના અર્થમાં વધારો થાય છે, માટે ‘ધણું’ “વિધિવાચક દિશેષણનું વિશેષણ” કહેવાય.

પાંચમા વાક્યમાં ‘જલદી’ ‘કિયાવિશેષણ અવ્યાય’ છે, પરન્તુ છુટ્ટો વાક્યમાં ‘જલદી’ પહેલાં ‘ધણો’ આવવાથી તેના અર્થમાં વિશેષ થાય છે, માટે ‘ધણો’ “કિયા-વિશેષણ અવ્યાયનું વિશેષણ” કહેવાય.

આ ઉપરથી નીચેનો નિયમ ઉપજાની શકાયઃ—  
વિશેષણ એ નામ, વિશેષણ, અને કિયાવિશે-  
ષણ અવસ્થાના અર્થમાં વધારે કરે છે.

### નોઈએ.

૧. તેણે જવું નોઈએ.

૨. તમારે લુગડાં પહેરવાં નોઈએ.

૩. આરે લાડુ અવસ્થ નોઈએ.

આ વાક્યો ઉપરથી જણાશે, કે ‘નોઈએ’માં ‘કરજ’  
કે ‘જરર’ના અર્થનો સમાવેશ થાય છે. ‘જવું નોઈએ’  
એટલે ‘જવાની કરજ છે,’ ‘પહેરવાં નોઈએ’ એટલે  
'પહેરવાની કરજ છે,' અને ‘લાડુ નોઈએ’ એટલે લાડુની  
જરર છે.’ આ વાક્યોનું પૃથકુરણ નીચે મુજબ થાયઃ—

ઉત્તેશ્ય.	વિધેય.	વિ. વ.
-----------	--------	--------

૧. તેણે	જવું નોઈએ.	
---------	------------	--

૨. તમારે	લુગડાં પહેરવાં નોઈએ.	
----------	----------------------	--

૩. આરે	લાડુ નોઈએ.	અવસ્થ.
--------	------------	--------

### વિધીય.

#### કિયા.

#### કિયાપૂરક.

૧.	જવું નોઈએ.	x
----	------------	---

૨.	પહેરવાં નોઈએ.	લુગડાં.
----	---------------	---------

૩.	નોઈએ.	લાડુ.
----	-------	-------

‘નોઈએ’, ‘અપૂર્વું કિયાપદ’ કહેતાય છે, કારણ  
કે ગુજરાતીમાં તેનાં બધા કાગમાં રૂપો થતાં નથી. નીચેના  
કોઢા ઉપરથી આ બાબત વધારે સ્પષ્ટ થશે.

કાળ.	નિશ્ચયાર્થ.	સંશ્યાર્થ.
વર્તમાન.	જોઈએ-જોઈએ છે.	જોઈએ-જોઈતો ( તી-તું ) હોય.
જીત.	x જોઈતો ( તી તું ) હતો ( તી-તું ).	જોઈતો ( તી-તું ) હોત.
ભવિષ્ય.	જોઈશે x	જોઈશે-જોઈતો (તી-તું)હોય કે હશે.

---

## પૃદ્ધચેદના નસુના.

( ૧ ) તેણે જરૂરું જોઈએ.

જરૂરું જોઈએ. અકર્મક કિયાપદ, જ ધાતુ, વિધ્યર્થ વર્તમાન કાળ, કર્તા તેણે, કિયાનાથ ભાવ, ત્રીજો પુ. નાન્ય. જતિ, એકવચન, ભાવે પ્રયોગ.

( ૨ ) તમારે લુગડાં પહેરવાં જોઈએ.

પહેરવાં જોઈએ. સકર્મક કિયાપદ, પહેર ધાતુ, વિધ્યર્થ વર્તમાન કાળ, કર્તા તમારે, કર્મ લુગડાં, કિયાનાથ લુગડાં, સકર્મક કર્મણ્ણ પ્રયોગ.

( ૩ ) મારે લાડુ જોઈએ.

જોઈએ. અપૂર્ણ કિયાપદ, વર્તમાન કાળ, નિશ્ચયાર્થ, કર્તા મારે, કર્મ લાડુ, કર્મણ્ણ રચના.

સંસ્કૃતમાં આવી રચના સાધારણું છે:—જેમકે, મયા મોદક: અપેક્ષયતે ગુજરાતીમાં નામની સાથે અને ત્રણે પુરુષમાં ચોથી વિભક્તિ વપરાય છે:—જેમકે, મોહનને, મને, તને, કે તેને લાડુ જોઈએ. પહેરા અને બીજા પુરુષમાં ત્રીજી પણ આવે છે:—જેમકે, મારે, અમારે, તારે કે તમારે લાડુ જોઈએ.

### કેવળપ્રયોગી અવ્યય.

‘અરે ! તેણે કેવું કૂર કામ કર્યું !’ ‘વાહ ! વાહ ! મારા ભાઈ, તમે આવું થું બોલો છો !’ આ બંને વાત્મો તપાસતાં જણ્યાય છે, કે ‘અરે !’ અને વાહ ! વાહ !’ એ શબ્દો તેની પછી આવતા વાક્યથી તદ્દન નિરાળા છે. અત્યાર સુધીમાં વાક્યમાં આવતા શબ્દોનો ઉદ્દેશ્યના કે વિધેયના વધારા તરીકે સમાવેશ કરેવાનાં આવ્યો છે; પરન્તુ ‘અરે !’ અને ‘વાહ ! વાહ !’ આ શબ્દો—અવ્યયો તો વાક્યથી તદ્દન છુટાજ પડી ગયેલા દેખાય છે, માટે તેવાને ‘કેવળપ્રયોગી’ ‘કેવળ = એકલો; પ્રયોગી=વપરાશમાં આવનાર’ અવ્યય કહે છે. અહાહા !, અરેરે !, ધિકું !, અધધધ !, કટ કટ !, અં !, આહા !, એ !, ઓ !, ઓાયરે !, ઓહો !, હાં !, ચુપ, છટ, થુ, બસ, લદે, રે, વાહરેવાહ, વાર, હન, હડ, હાય, હાયહાય, હાઉં, હાશ, હે, હો, હા, વગેરે, વગેરે, કેવળપ્રયોગી અવ્યયો છે. વાક્યથી તદ્દન નિરાળા પડી ગયેલા અવ્યયોને ‘વાક્યપૃથક્કરણ’માં પડતા મૂકવા.

### સમાસ.

‘રામલક્ષ્મણુ,’ ‘રાજકુવર,’ ‘પરમેશ્વર,’ ‘વરાળિયત્ર,’ ‘ચંદ્રમુખી,’ ‘યથાશક્તિ,’ ‘રામ અને લક્ષ્મણુ,’ ‘રાણનો કુવર,’ ‘પરમ (મોટો) ઈશ્વર,’ ‘વરાળનું યંત્ર,’ ‘ચંદ્રના જેવું મુખ છે જેનું તે,’ ‘શક્તિ પ્રમાણે,’ આ રીતે ઉપર આવેલા શબ્દોનો સંબંધ સ્પષ્ટ કરવાથી તેના અર્થ સમજાય છે.

જ્યારે એ કે વધારે શબ્દો એકઠા ભળી તેનો એક શાફના જોવોજ ઉપયોગ થાય છે, ત્યારે તે શબ્દોનો સમાસ થયો કહેવાય.

સમાસ પામેલા શબ્દોના અર્થ સમજાવવા જોડી દીખેલા શબ્દોને છુટા પાડવા પડે છે.

## સમાસનાં પદ.

‘રાજકુંવર’ સમાસના પ્રથમના શબ્દ ‘રાજ’ ને  
પૂર્વપદ ‘અને તેના છેદલા શબ્દ ‘કુંવર’ ને ‘ઉત્તરપદ’ કહે છે.

## સમાસના પ્રકાર.

શબ્દાન્તમાં ને શબ્દોને છુટા કરી બનાવ્યા છે તે  
ઉપરથી સમજાયું દશે, કે શબ્દો જુદી જુદી રીતે છુટા  
પાડી રખાય છે. જુદી જુદી રીત મુજબ સમાસની જતો  
પણ જુદી જુદી થાય છે.

## કુદ્દ સમાસ.

‘રામનક્ષમણુ’ ‘રાજગણી’ ‘જગસ્થળનાયુતેજ’  
આ જાતના સમાસને ‘દુદ્દ’ કહે છે. દુદ્દ એટલે જાહુ. એ કે  
એથા વધારે એકજ વિભક્તિનાં નામે જેડી હાથેલાં હોય છે,  
તારે સમાસ ‘દુદ્દ’ કહેવાય છે. ‘અને’ કે ‘નથા’ શબ્દો  
વર્ણે મૂકવાથી અર્થ સમજાય છે:—જેમકે, રાજ અને રાણી.

## તત્પુરૂપ સમાસ.

‘તત્પુરૂપ’ શબ્દ પોતેજ તત્પુરૂપ સમાસ છે.

તત્પુરૂપ=તેનો પુસ્તા.

શોકાતુર = શોક વડે આતુર. ( ત્રીજ વિભક્તિ).

સ્થાનબ્રહ્મ=સ્થાનથી બ્રહ્મ. ( પાંચમી „ ).

સ્વર્ગનાસ=સ્વર્ગમાં વાસ. ( સાતમી „ ).

આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વર્ણનો સંબંધ  
ભીલુથી સાતમી વિભક્તિ સુધીની કોઈ પણ વિભક્તિથી  
બતાવાય છે. સમાસના પૂર્વપદને અધ્યાલાર રહેલી વિભક્તિ  
લાગુ પાડનાથી દરેક પદનો જુદો અર્થ તેમજ સમાસનો એક  
સંયુક્ત અથ સમજાય છે.

## અનુક તત્પુરૂપ સમાસ.

લુદ્દ = પ્રત્યયનો લોપ; અનુક = જેમાં પ્રત્યયનો લોપ

થયો નથી તે. ‘યુધિષ્ઠિર’ ‘કર્તરિપ્રયોગ’ ‘કર્મધ્ય-પ્રયોગ’ ‘ભાવેપ્રયોગ’ આ સમાસોમાં વિલક્ષિતના પ્રત્યો કાયમ રહ્યા છે.

### નાન્દુ નત્તુરૂપ સમાસ.

‘અણુખનાવ,’ ‘અસલ,’ વગેરે સમાસ પામેલા શાદોમાં પૂર્વપદ નકારવાચક છે. આવા સમાસને ‘નાન્દુ તત્ત્વરૂપ’ કહે છે.

### કર્મધારય સમાસ.

મહાદેવ = મોટા દેવ.

સહગુણ = સારો ગુણ.

ચંદ્રમુખ = ચદ્ર જેવું મુખ.

મુખચંદ્ર = મુખ એજ ચન્દ્ર.

કર્મધારય સમાસમાં પૂર્વપદ ગુણવાચક વિશેષણ અથવા ગુણવાચકના અથવા વરાયેલું ભીજું ડાઈ પણ નામ હોય છે.

### દ્વિગુ સમાસ.

‘ત્રિભુનત,’ ‘ચતુર્બેદ,’ આ શબ્દોના અર્થ ત્રણ ભુબનનો અનો ચાર વેદોનો સમુદ્રાય એ પ્રમાણે થાય છે. પૂર્વપદ ગુણવાચક વિશેષણને બદલે સંખ્યાવાચક વિશે-પણ હોય છે. દ્વિગુ સમાસ એ કર્મધારયનો પેટાભાગ છે. દ્વિગુ શબ્દમાં ‘દ્વિ’ સંખ્યાવાચક વિશેષણ હોવાથી આ જાતના સમ સ ધાર રાખતાનું સહેલું થઈ પડે.

### મધ્યમપદલોપી સમાસ.

દહીવડા = દહીમાં આથેલાં વડાં. આ સમાસને છાડતી વેળા પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનો સંબંધ દેખાડવા એક અથવા નધારે શબ્દો વચ્ચેમાં મૂકવાની જરૂર પડે છે. મધ્યના પદનો લોપ થયો છે, માટે આવા સમાસને ‘મધ્યમ-પદલોપી’ કહે છે.

### બહુવ્રીહિ.

મહાઆહ = મોટા છે હાથ જેના તે.

પીતાંખર = પીળું અંખર (વખ) પહેર્યું છે જેણે તે.

આ પ્રમાણે જે સમાસ છાડી શકાય છે તે  
 ‘બહુવ્રીહિ’ કહેવાય છે. ‘બહુવ્રીહિ’ શાબ્દ ચોતેજ બહુવ્રીહિ સમાસ છે; બહુ છે વ્રીહિ (ડાંગેર) જેની પાસે તે. જે સમાસને બહુવ્રીહિ શાબ્દની પેડે છાડી શકાય છે તેને ‘બહુવ્રીહિ સમાસ’ કહે છે.

### અવ્યયીભાવ.

‘પ્રતિહિન,’ ‘યથાશક્તિ’ આ સમાસમાં ‘હિન’ કે ‘શક્તિ’ અવ્યય નથી; પરંતુ ‘પ્રતિ,’ અને ‘યથા’ અવ્યયો સાથે આવવાથી ‘પ્રતિહિન,’ અને ‘યથાશક્તિ,’ એ શાબ્દો અવ્યય જેવા થાય છે, માટે આવા સમાસને ‘અવ્યયીભાવ’ કહે છે.

પ્રતિહિન = દિને દિને.

યથાશક્તિ = શક્તિ પ્રમાણે.

### સંધિ.

સંધિ ( સં=સાથે; ધા=મૂડવું, રાખવું ) સાથે મૂડવું કે રાખવું; સંધિ એટલે સંપ્રાણુ.

### સ્વરસંધિ.

૧. બારાક્ષરી = બાર + અક્ષરી.      }      અ + અ = આ.  
 શાખાર્થ = શાખ + અર્થ.      }      અ + અ = આ.

૨. સિંહાસન = સિંહ + આસન.      }      અ + અ = આ.  
 ધર્માત્મા = ધર્મ + આત્મા.      }

૩. વિદ્યાર્થી = વિદ્યા + અર્થી.  
 વિદ્યાભ્યાસ = વિદ્યા + અભ્યાસ. } આ + અ = આ.  
 વિદ્યાલય = વિદ્યા + આલય. } આ + આ = આ.

નિયમ.-અ કે આ પછી અ કે આ આવે તો આ થાય છે.

૧. હરીછણ = હરિ + છણ. ઈ + ઈ = ઈ.
૨. કવીશર = કવિ + શર. ઈ + ઈ = ઈ.

નિયમ.-ઈ કે ઈની પછી ઈ કે ઈ આવે તો ઈ થાય.

૧. ભાનુહય = ભાનુ + હય. ઊ + ઊ = ઊ.

નિયમ.-ઉ કે ઊ પછી ઉ કે ઊ આવે તો ઊ થાય.

૧. ગનેન્દ્ર = ગન્ધ + ન્દ્ર. અ + ઈ = એ.
૨. મહેન્દ્ર = મહા + ન્દ્ર. આ + ઈ = એ.
૩. મહેશ્વર = મહા + શર. આ + ઈ = એ.

નિયમ.-અ કે આ પછી ઈ કે ઈ આવે તો એ થાય.

૧. સૂર્યોદય = સૂર્ય + ઓદય.
૨. શાળાપયોગી = શાળા + ઓપયોગી.

નિયમ.-અ કે આ પછી ઊ કે ઊ આવેતો એ થાય.

૧. દેવર્ષિ = દેવ + ર્ષિ.

નિયમ.-અ કે આ પછી ઝડ આવે તો ઝરૂ થાય.

૧. દેવશર્ય = દેવ + શર્ય.

૨. એકેક = એક + એક.

૩. ઉત્તમીપથિ = ઉત્તમ + એપથિ.

નિયમ.-અ કે આની પછી એ કે એ આવે તો એ,  
 અને એ કે આ આવે તો એ થાય.

૧. અત્યંત = અતિ + અંત.

૨. પ્રતિયુતર = પ્રતિ + ઉતર.

૩. મન્વાદિ = મનુ + આદિ.

નિયમ.-હસ્ત કે દીર્ઘ છ, ઉ, કે જી પણ કોઈ પણ  
વિજાતીય સ્વર આવે, તો તેને બદલે અનુ-  
ક્રમે ય, વ્ય, અને ર્ય, થાય.

૧. ગાયત = ગી + અન.

૨. નાવિક = નૌ + ઇક.

નિયમ.-એ, એ, ઓ, ઔ પણ કોઈ પણ સ્વર આવે  
તો અનુક્રમે, અય, આય, અવ, આવ, થાય.

---

### વંજનસંધિ.

૧. સદ્ગાયાર = સત્ + આચાર

૨. સદ્ગુણ = સત્ + ગુણ.

નિયમ.-કોઈ અધોાપ વંજનની પાસે બોધ અક્ષર  
કે સ્વર આવે, તો તે અધોાપ વંજનને ઠેકાણે  
તે વર્ગના ગ્રીંજે વંજન થાય

૧. સર્વચિત્ર = સત્ + ચિત્ર.

૨. સજજન = સત્ + જજન.

૩. ઉલ્કાસ = ઉત્ + લાસ.

નિયમ.-દંતસ્થાની પણ તાલુ, મૂર્ધસ્થાની કે લ  
આવે તો પોતે તેવાજ થઈ જાય.

૧. સર્વશાસ્ત્ર = સત્ + શાસ્ત્ર.

૨. અચ્છેર = અધ' - અધ' - અધ' + શેર.

નિયમ.—એજિન શાખની શરૂઆતમાં શાંખાવે અને  
પહેલાને અંતે દંત્ય હોય, તો તે દંત્યનો  
બ્રથાય છે, અને શાંખનો છ્રથાય છે.

૧. જગનાથ = જગત + નાથ.

૨. ઉન્મત = ઉદ્ + મત.

નિયમ.—એજિન શાખની શરૂઆતમાં અતુનાસિક  
અક્ષર હોય, તો પહેલા શાખને અંતે જે  
અક્ષર આવે છે તે પોતાના વર્ગનો અતુ-  
નાસિક થાય છે.

ઉપર સ્વર અને વ્યંજનની સંધિના મુખ્ય મુખ્ય  
નિયમો આવ્યા છે. ગુજરાતીમાં સંધિ કરવાનું બહુ જોવ માં  
આવતું નથી. સંધિ કરવાની ઇંડી સંસ્કૃતમાં ધણીજ  
સામાન્ય છે. ગુજરાતી ભાષામાં ધણા સંસ્કૃત શાખા વપરાય  
છે, તેથી ભાત્ર સ્વર તેજ વ્યંજનની સંધિના નિયમોનું  
અહીં કુંકું વિવેચન કરેલું છે.

### વિરામચિહ્ન.

ઓલતી કે લખતી વેળા અર્થ બરાબર સમજય,  
માટે શાખ કે વાક્યની વચ્ચેમાં થોડી કે વધારે વાર અટ-  
કવાની જરૂર પડે છે. કયાં કેરલું અટકલું, એ બરાબર  
સમજય, માટે કેટલીક નિશાનીઓ મુકરર કરેલી છે. આવી  
નિશાનીઓને ‘વિરામચિહ્ન’ (વિ + રમ = થોબલું,  
અટકલું) કહે છે. મુખ્ય વિરામચિહ્નો નીચે મુજબ છે—

૧. અલ્પવિરામ. ( , ) ૨. અધ્ર્વવિરામ. ( ; ) ૩. ગુરુ-

વિરામ. ( : ) ૪. પૂર્ણવિરામ. ( . ) ૫. પ્રશ્નચિહ્ન. ( ? )  
 ૬. ઉદ્ગારચિહ્ન. ( ! ) ૭. અવતરણચિહ્ન. ( ' ' )  
 " " ) ૮. કેંસ. [ ] ઇ ( ) ૯. અપસારણચિહ્ન.  
 ( — — ).

### અધ્યપનિરામ.

જે શબ્દો સમાનાંથે હોય તેની વચ્ચમાં અધ્યપનિરામ આવે:—જેમકે, દશરથના પુત્ર, શ્રી રામચંદ્રજી વનવાસ ગયા. લંકાના રાજ, રાવણ મરાયો.

૨. એકજ પ્રકારના ત્રણ કે તેથી વધારે શબ્દો સાથે આવે, અને છેલ્ખા એ ‘અને’ થી જોડાય, તો પહેલાંના દરેક શબ્દ પછી અધ્યપનિરામ સુકાય:—જેમકે, ઓસ, ધટલી, અને સ્પેન યુરોપની દક્ષિણે આવેલા દીપકલ્પો છે. વિદ્વાન, ડાલ્ચા, અને વિવેકી શિક્ષકને સૌ ચાહે છે. આપણે દરેક કામ ધીરજથી, ચતુરાઈથી, અને ઘંઠથી કરવું જોઈએ. આતું તો જુના કાળથી થતું આવ્યું છે, હાલ પણ થાય છે, ને ભવિષ્યમાં પણ થશે.

૩. સંખોધનાંથે આવેલા શબ્દો પછી અધ્યપનિરામ સુકાય છે:—જેમકે, કોંકણીભાઈ, વનના રાજજી માંદા પડ્યા છે, તેને તમે જોવા નહિ આવો?

૪. એકજ વર્ગના શબ્દનાં જુદાં જુદાં જોડકાં સાથે આવે છે, ત્યારે દરેક જોડકા વર્ચ્યે અધ્યપનિરામ સુકાય છે:—જેમકે, ધરમાં કે ધરની બહાર, દ્વિવસે કે રાતે, તે પૈસાનેજ વિચાર કર્યા કરે છે.

૫. અને, માટે, તેથી, પણ, પરન્તુ, છત્યાછિ શબ્દો કાઈ વાક્યમાં આવે, અને જે તે વાક્ય કુંકં હોય તો

નહિ, પણ લાંબું હોય તો આ શબ્દોની પૂર્વે અધ્યપિતામ સુકાય છે:—જેમકે, રામ અને લક્ષ્મણું વનમાં જવા નીકળ્યા. તે મેડા થયો તેથી ગાડી ચાલી ગઈ. એક વેળા એક લોંકડીને દ્રાક્ષ આવાની છચ્છા થઈ, પણ તે એટલી બધી હંચી હતી, કે તેનાથી પહેંચી શકાય એમ નહતું.

૬. ‘વગેરે,’ ‘ધ્રત્યાદિ’ પહેલાં, અને ‘છેવટે,’ ‘દુંકામાં,’ પછી ધણે લાગે અધ્યપિતામ સુકાય છે.

### અર્ધવિરામ.

ન્યારે અધ્યપિતામથી વધારે વખત અટકવાની જરૂર પડે છે, ત્યારે ‘અર્ધવિરામ’ સુકાય છે:—જેમકે, પ્રામાણિકપણ્યાથી ધણ્યા ધણ્યા લાભ છે; લોકો આપણુને ચાહે છે; આપણું કામ સરળતાથી થાય છે; સૌથી મોટો લાભ તો એ કે ધીશ્વર આપણા ઉપર પ્રસન્ન રહે છે.

### ગુરુવિરામ.

આ ચિહ્નન એકલું બહુ વપરાતું નથી. ને કંઈ કહ્યું હોય, તેમાં કંઈ દિશાંતરે ઉમેરવું હોય, ત્યારે આ ચિહ્નન વપરાય છે. ધાન્યની ધણી જાતો થાય છે:—જેવીકે, ધઉ, ચણ્યા, બાજરી, જુવાર, વગેરે.

### પૂર્ણવિરામ.

વાક્ય પુરું થાય છે, ત્યારે પૂર્ણવિરામ (.) સુકાય છે. આજો આપવી હોય કે આશીર્વાદ આપવા હોય, ત્યારે પણ વાક્યને છેડે પૂર્ણવિરામજ સુકાયઃ—જેમકે, રાજાજીનો ફુકમ છે કે આ કામ તમારે કરેલું. આ કામ જલદી તૈયાર કરો. પરમેશ્વર તમારું બલ્યું કરો.

### પ્રક્રિયિહ્ન.

વાક્યમાં સત્તાત્ પૂછ્યો હોય છે, તો તેની પણી પ્રક્રિયિહ્ન મુક્તાય છે:—જેમકે, હિનુસ્તાનમાં કોનું રાજ્ય છે? હિનુસ્તાનમાં અંગેજ લોકો ક્યારે આવ્યા?

જ્યારે પ્રક્રાર્થ વાક્ય પેટા વાક્ય હોય, ત્યારે પ્રક્રાર્થ-ચિહ્ન મુક્તાય નહિઃ—જેમકે, હિનુસ્તાનમાં કોનું રાજ્ય છે એમ શિક્ષકે મને પૂછ્યું.

### ઉદ્ગારચિહ્ન.

એક અથવા અનેક શબ્દથી કે કોઈ વાક્ય ઉપરથી હર્ષ, શોક, આશ્રય, વગેરનો એધ થતો હોય, તો તેને છેડે ઉદ્ગારચિહ્ન મૂક્તવામાં આવે છે:—જેમકે, અરેરે! તે મોડો આવ્યો એ કુટલું બધું ખાડું! તેના શબ્દો સાંભળી હું તો હિંગજ થઈ ગયો! ભંઘોધનને છેડે પણ ઉદ્ગારચિહ્ન આવે છે:—જેમકે, અરે રાજ! તને શું થયું?

### અવતરણચિહ્ન.

ભીજ કોઈના વિચાર અથવા ભીજ કોઈનું એલેક્ટુનું કે કહેલું તેનાજ શબ્દોમાં દર્શાવવું હોય, તો તે શબ્દોની પહેલાં અને પછી “ ” આવાં અવતરણચિહ્ન મુક્તાય છે. જે વાક્ય નાનું સરખું હોય તો માત્ર ‘ ’ આવાં ચિહ્નનો મૂક્તવામાં આવે છે.

### કૌંસ.

કોઈ વાક્યમાં અર્થી સ્પષ્ટ જાણુવવા માટે વાક્યની સાથે ખાસ સંબંધ ન હોય એવી હકીકત વચ્ચે લાવવામાં

આવે છે. એ હકીકત એવી હોય છે, કે તે બાતથી કરી  
હોય તો તેથી વાક્યના અર્થમાં કંઈ હેર પડતો નથી.  
આવી હકીકત [ ] આવા અથવા ( ) આવા  
કેંસમાં મુકાય છે. રાજ્યનો ખરો વારસ શિવાજી ( એટલે  
સંભાળનો છોકરો ) તે વખતે માત્ર છ વરસનો હતો, તેથી  
રાજ્યનો ખરો કારબાર તેનો કંડો રાજરામ ચલાવતો હતો.

### અપસારણચિહ્ન

હકીકત લખતાં લખતાં તે હકીકતને વધારે સ્પષ્ટ  
કરવાને અથવા વચ્ચમાં સૂઝ આવેલા વિચાર દર્શાવવા તેની  
પહેલાં——આં, અને તેની પછી પણ——આં એવાં  
એ ચિહ્નનો મુકાય છે. આ ચિહ્નનો અપસારણચિહ્નનો કહેવાય  
છે. આપણે અનેક ભાષા બોલનારા——ગુજરાતી, સિંહિ,  
પંજાબી, બંગાળી——એકજ દેશના છીએ.

અ. અ. અ. અ. અ. અ. અ.  
 અ. અ. અ. અ. અ. અ. અ.  
 અ. સમાન. અ. અ.  
 અ. અ. અ. અ. અ. અ.

